

# PANTH Infinity INTENDED TO INSPIRE

Date: 1st June, 2022

To.

**BSE** Limited

The Department of Corporate Services

P. J. Towers, Dalal street,

Mumbai-400 001.

Maharashtra.

**BSE Code: 539143** 

To.

The Calcutta Stock Exchange Limited

The Compliance Department 7, Lyons Range, Dalhousie, Murgighata, B B D Bagh,

Kolkata-700001, West Bengal

**CSE Code: 30010** 

Sub: Newspaper Publication of Audited Financial Results for the Quarter and Year ended 31st March, 2022.

Dear Sir/Madam,

Pursuant to the provisions of Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, we are pleased to enclose herewith a Newspaper Copy of extract of Audited Financial Results of the company for the Quarter and Year ended 31st March, 2022 published in "Financial Express" (English) and "Gujarat Guardian" (Gujarati) Newspaper dated 1st June, 2022.

Kindly take the same on your record and oblige.

Thanking you,

Yours faithfully,

FOR PANTH INFINITY LIMITED

ARPIT JAIN

Company Secretary & Compliance Office

ACS No.: 66322

PANTH INFINITY LIMITED | CIN: L45201GJ1993PLC114416

Registered Office: 101, Siddh Chambers, Taratiya Hanuman Street, Gurjar Faliya, Haripura, Surat-395003, Gujarat.

1 +91-70439 99011 a info@panthinfinity.com b panthcompliance@gmail.com





www.panthinfinity.com

## PANTH INFINITY LIMITED

(CIN: L45201GJ1993PLC114416) Tel: 7043999011, Email: info@panthinfinity.com, Website: www.panthinfinity.com

Extract of Standalone Audited Financial Results for the								
Quarter and Year Ended 31st March, 2022 (₹. in lakhs except EP								
Sr.		0	uarter ende	d	Year	ended		
No.	Particulars	31.03.2022	31.12.2 <b>0</b> 21	31.03.2021	31.03.2022	31.03.202		
		(Audited)	(Un-audited)	(Audited)	(Audited)	(Audited)		
1	Total income from operations (net)	398.55	279.68	1135.48	1458.87	2164.44		
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	-6.75	-4.45	-49.36	-0.07	7.64		
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	-6.75	0.54	-27.31	5.11	30.09		
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	-0.80	0.56	-14.69	4.27	26.71		
5	Total comprehensive Income for the period [comprising Profit/ (Loss) for the period (after tax) and other Comprehensive Income (after tax)]	-87.51	-1.39	-21.31	-82.24	32.02		
6	Equity Share Capital (face value of Rs. 10/- each)	1232.50	1232.50	1232.50	1232.5	1232.5		
Reserves (excluding Revaluation Reserve as shown in the Audited Balance Sheet of previous year)		-	-	-	1030.54	1026.20		
8	Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations)							
	(a) Basic EPS	-0.01	0.00	-0.12	0.03	0.22		
	(b) Diluted EPS	-0.01	0.00	-0.12	0.03	0.22		

The above is an extract of the detailed format of audited Financial Results for the Quarter and year ended on 31.03.2022 filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly and yearly audited Financial Results is available on the Stock Exchange website: www.bseindia.com and on the Company's Website: www.panthinfinity.com

The above financial Results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at their respective meetings held on 30th May, 2022.

The results have been prepared in accordance with the Indian Accounting Standards (Ind AS) as prescribed under Section 133 of the Companies Act, 2013 read with relevant rules issued thereunder. For PANTH INFINITY I IMITED

Date: 30.05.2022

Jinay Koradiya Chairman & Managing Director (DIN: 03362317)

#### STARLINEPS ENTERPRISES LIMITED (formerly known as Starline Precious Stone Limited) (CIN: L36910GJ2011PLC065141)

Reg. Off.: Shop - F/1, 1st Floor, Athwa Ark Shopping Centre. Opp. Yatim Khana, Athwa Gate, Surat-395001, Gujarat Tel.: 0261-2600343, Email: info@starlineps.com, Website: www.starlineps.com

Statement of Standalone Audited Financial Results for the Quarter

	and Year Ended 31st March, 2022								
	and fear Ended 31st Warch, 2022 (₹ in lakhs except EPS								
Sr.		(	Quarter en	ided	Year E	nded			
No.	Particulars Particulars	31/03/2022	31/12/2021	31/03/2021					
		(Audited)	(Unaudited)	(Audited)	(Audited)	(Audited)			
1	Total income from operations (net)	567.42	373.00	651.20	1642.3	1853.98			
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	7.68	14.36	-130.97	40.04	19.43			
3	Net Profit /(Loss) for the period before Tax (after Exceptional and/or Extraordinary items)	7.68	14.36	-130.97	40.04	19.43			
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	5.35	12.16	-123.09	30.71	16.06			
5	Total comprehensive Income for the period [comprising Profit/(Loss) for the period (after tax) and other Comprehensive Income (after tax)]	5.35	12.16	-123.09	30.71	16.06			
6	Paid up Equity Share Capital (Face value of Rs.5 each)	2161.50	2161.50	2161.50	2161.5	2161.5			
7	Reserves (excluding Revaluation Reserve as shown in the Balance Sheet of previous year)	-	-	-	225.81	203.75			
8	Earnings per share (of Rs. 5/- each) (for continuing and discontinued operations)								
	(a) Basic EPS	0.02	0.03	-0.30	0.09	0.04			
	(b) Diluted EPS	0.02	0.03	-0.30	0.09	0.04			
No	to:								

Note:

- . The above is an extract of the detailed format of audited Financial Results for the Cuarter and year ended on 31.03.2022 filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly and yearly audited Financial Results is available on the Stock Exchange website; www.bseindia.com and on the Company's Website: www.starlineps.com 2. The above financial Results have been reviewed by the Audit Committee and
- approved by the Board of Directors at their respective meetings held on 30th May
- The results have been prepared in accordance with the Indian Accounting Standards (Ind AS) as prescribed under Section 133 of the Companies Act, 2013 read with relevant rules issued thereunder

FOR STARLINEPS ENTERPRISES LIMITED (Formerly known as Starline Precious Stone Limited) SHWETKUMAR KORADIYA

Date: 30-05-2022

Arvind

Chairman & Managing Director DIN: 03489858 Place : Surat.

## **PRASHANT INDIA LIMITED**

REGD. OFFICE- BLOCK NO 456 PALSANA CHARRASTA PALSANA DIST SURAT GJ 394315 PH-7228086858 CIN: L15142GJ1983PLC006574. E MAIL ID: CS.PRASHANTINDIA@GMAIL.COM

STATEMENT OF STANDALONE AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED 31.03.2022						
			(Rs	. In lakhs)		
Particulars	Quarter ended 31.03.2022 Audited	Quarter ended 31.03.2021 Audited	Year ended 31.03.2022 Audited	Year ended 31.03.2021 Audited		
Total income from operations (Net)	38.34	31.81	108.55	92.62		
Net Profit / (Loss) from ordinary activities after tax	3.09	16.09	(15.75)	0.02		
Net Profit / (Loss) for the period after tax (after Extraordinary items)	3.09	16.09	(15.75)	0.02		
Equity Share Capital	423.54	423.54	423.54	423.54		
Reserves (excluding Revaluation Reserve as shown in the Balance Sheet of previous year)			(3664.56)	(3648.81)		
Earnings Per Share (before extraordinary items) (of Rs. 10/- each) Basic & Diluted:	0.07	0.38	(0.37)	0.00		
Earnings Per Share (after extraordinary items) (of Rs. 10/- each) Basic & Diluted :	0.07	0.38	(0.37)	0.00		

Note: The above is an extract of the detailed Quarterly and yearly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the same are available on the Stock Exchange websites at www.bseindia.com For Prashant India Limited

s/d Authorised Signatory

## PERMANENT MAGNETS LIMITED

Place : Palsana

Place: Thane Date: May 30, 2022

Regd Office: Harsh Avenue, 302, 3rd Floor, Opp. Silvassa Police Station, Silvassa - 396230. Dadra & Nagar Haveli (U.T.)
Corporate office: B-3, MIDC, Village Mira, Mira Road (East), Thane - 401107.
CIN: L27100DN1960PLC000371 • Email: investors@pmlindia.com • Phone: +91 22 68285454
Website: www.pmlindia.com

(Rs. In Lakhs except per share data Extract of the Standalone Audited Financial Results for the Quarter and Year Ended March 31, 2022

0		For t	he Quarter E	nded	Year I	Ended
Sr. No.	Particulars	31.03.2022 Audited	31.12.2021 Unaudited	31.03.2021 Audited	31.03.2022 Audited	31.03.2021 Audited
1. 2.	Total Income from operations (net) Net Profit/(Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	3,988.50 811.58	2,864.18 479.73	3,765.15 792.73	13,325.90 2,556.57	11,756.51 2,182.08
3.	Net Profit/(Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	811.58	479.73	792.73	2,556.57	2,182.08
4.	Net Profit/(Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	604.79	360.15	642.10	1,904.43	1,613.79
5.	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and other Comprehensive Income (after tax)]	605.80	360.15	643.69	1,905.45	1,615.38
6. 7.	Paid up Equity Share Capital (Face Value Per Share Rs. 10/-) Earnings Per Share (before and after Extraordinary items)	859.85	859.85	859.85	859.85	859.85
	Basic:     Diluted:	7.05 7.05	4.19 4.19	7.49 7.49	22.16 22.16	18.79 18.79

Note: The above is an extract of the detailed format of Quarter and Year ended March 2022 financial results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarter and Year ended financial results are available on the Stock Exchange website: www.bseindia.com. The same is also available on the Company's website: www.pmlindia.com

By order of the Roard For Permanent Magnets Ltd Sharad Taparia **Managing Director** 

## AMBITIOUS PLASTOMAC COMPANY LIMITED

(CIN: L25200GJ1992PLC107000)

Regd Office: 405, Royal Square, Near JBR Arcade, Science City Road, Sola, Ahmedabad-380060, Gujarat E-mail id: ambitiousplasto@gmail.com | Website: www.ambitiousplasto.com

SI.			Quarter En	Year Ended		
No.	Particulars	31.03.2022 (Audited)	31.12.2021 (Unaudited)	31.03.2021 (Audited)	31.03.2022 (Audited)	31.03.202 <sup>2</sup> (Audited)
1.	Total income from operations (net)	-	-	-	-	
2.	Net Profit / (Loss) for the period (before Tax,					
	Exceptional and/or Extraordinary items)	(5.62)	(2.47)	(4.30)	(12.21)	(10.94
3.	Net Profit / (Loss) for the period before tax	` ´	. ,	, ,	, ,	,
	(after Exceptional and/or Extraordinary items)	(5.62)	(2.47)	(4.30)	(12.21)	(10.94
4.	Net Profit / (Loss) for the period after tax	, ,	, ,	, ,	, ,	,
	(after Exceptional and/or Extraordinary items)	(5.62)	(2.47)	(4.30)	(12.21)	(10.94
5.	Total Comprehensive Income for the period	, ,	, ,	, ,	, ,	,
	[Comprising Profit / (Loss) for the period (after tax)					
	and Other Comprehensive Income (after tax)]	(5.62)	(2.47)	(4.30)	(12.21)	(10.94
6.	Equity Share Capital	581.00	581.00	581.00	581.00	581.0
7.	Reserves (excluding Revaluation Reserve as					
	shown in the Balance Sheet of previous year)	-	-	-	(613.51)	(601.31
8.	Earnings Per Share (of Rs.10/- each)				, ,	,
	(for continuing and discontinued operations)					
	Basic:	(0.10)	(0.04)	(0.07)	(0.21)	(0.19
	Diluted:	(0.10)	(0.04)	(0.07)	(0.21)	(0.19

Note: The above is an extract of the detailed format of Financial Results for the Quarter and Year ended on 31st March, 2022 filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the website of the Company i.e. www.ambitiousplasto.com and on the website of BSE Ltd (www.bseindia.com)

For, AMBITIOUS PLASTOMAC COMPANY LIMITED

PINKAL R. PATEL MANAGING DIRECTOR Date: 31.05.2022 (DIN: 06512030) Place: Ahmedabad

## **ARVIND LIMITED** CIN - L17119GJ1931PLC000093 NARODA ROAD, AHMEDABAD - 380 025

Website: www.arvind.com: Email: investor@arvind.in Phone No. 079-68268000

TRANSFER OF EQUITY SHARES OF THE COMPANY TO INVESTOR EDUCATION AND PROTECTION FUND (IEPF) Notice is hereby given that pursuant to the provisions of Section 124(6) of the

Companies Act. 2013 read with the Investor Education and Protection Fund Authority (Accounting, Auditing, Transfer and Refund) Rules, 2016 ("the Rules"), the final dividend declared during the financial year 2014-15, which remained unclaimed for a period of seven years will be credited to the Investor Education and Protection Fund (IEPF) within 30 days of September 10, 2022. The corresponding shares on which dividend was unclaimed for seven consecutive years will also be transferred as per the procedure set out

In compliance to the Rules, the Company has communicated individually to the concerned shareholders at their registered address whose shares are liable to be transferred to IEPF, advising them to claim the dividends and the details of such shares are also made available on the Company's website

Concerned shareholders holding shares in physical form and whose shares are liable to be transferred to IEPF may note that upon such transfer, the original share certificate(s) which are registered in the name of original shareholders will stand automatically cancelled and be deemed non-negotiable. Concerned shareholders holding shares in dematerialized form may note that upon such transfer, shares shall be debited from their Demat account.

The shareholders may further note that the details made available by the Company on its website should be regarded and shall be deemed adequate notice in respect of issue of duplicate share certificate(s) by the Company for the purpose of transfer of shares to IEPF. In case the Company does not receive any communication from the concerned shareholders on or before September 10, 2022, the Company with a view to adhering with the requirements of the Rules, transfer the corresponding shares on which dividend is unclaimed for seven consecutive years shall also be transferred without any further notice

Please note that no claim shall lie against the Company in respect of unclaimed dividend amount and shares transferred to IEPF. Shareholders may claim the dividend and corresponding shares transferred to IEPF including all benefits accruing on such shares, if any, from the IEPF Authority after follow ing the procedure prescribed in the Rules.

For any queries on the above matter, Shareholders are requested to contact the Company's Registrar and Share Transfer Agents, Link Intime India Pvt. Ltd., 5thfloor, 506 to 508, Amarnath Business Centre - 1 (ABC-1), beside Gala Business Centre, Nr. St. Xavier's College Corner, Off C. G. Road, Ellisbridge Ahmedabad - 380006, Tel No.: 079-26465179/86/87, e-mail: <u>iepf.shares@link</u>

By order of the Board For Arvind Limited 31.05.2022 **Company Secretary** 

# MEERA

# **MEERA INDUSTRIES LIMITED**

[CIN: L29298GJ2006PLC048627] Regd. Office: Plot No. 2126, Road No.2, G.I.D.C., Sachin-394 230, Surat, Gujarat, India.

Website: www.meeraind.com tatement of Consolidated audited financial results for the Quarter and Year Ended 31st March, 2022

			Co	onsolidated	ł	
SI.			Year I	r Ended		
No.	Particulars	31.03.2022 (Audited)	31.12.2021 (Unaudited)	31.03.2021 (Audited)	31.03.2022 (Audited)	31.03.2021 (Audited)
1.	Total Income from Operations (net)	553.63	865.30	1,208.29	3,189.04	2,271.97
2.	Net Profit / (Loss) for the period before exceptional items and tax	1.22	126.91	218.30	377.21	285.98
3.	Net Profit / (Loss) for the period before tax	1.22	126.91	218.30	377.21	285.98
4.	Net Profit / (Loss) for the period after tax	(15.28)	107.67	177.88	267.07	214.66
5.	Total Comprehensive Income for the period (after tax)	(17.09)	108.07	178.28	266.45	216.25
6.	Equity Share Capital	1,067.88	1,067.88	1,067.88	1,067.88	1,067.88
7.	Other equity (excluding revaluation reserves)				1,547.08	1,408.78
8.	Earnings Per Share (of Rs. 10/- each) #					
	1. Basic	(0.14)	1.01	1.67	2.50	2.01
	2. Diluted	(0.14)	1.01	1.67	2.50	2.01

	rtoy realisons of Standarding I manifest resource for the Quarter and Four Endouron February							
					(Amour	it in Lakhs)		
SI. No.			Quarter E	nded	Year I	Ended		
No.	Particulars	31.03.2022 (Audited)	31.12.2021 (Unaudited)	31.03.2021 (Audited)	31.03.2022 (Audited)	31.03.2021 (Audited)		
1.	Total Income from Operations (net)	613.61	764.58	1,180.94	3,199.64	2,226.11		
2.	Net Profit / (Loss) for the period before tax	32.60	95.91	206.60	391.60	289.35		
3.	Net Profit / (Loss) for the period after tax	16.10	76.67	164.36	281.46	212.33		
4.	Total Comprehensive Income for the period (after tax)	14.29	77.07	164.76	280.84	213.92		

Key Numbers of Standalone Financial Results for the Quarter and Year Ended 31st March 2022

- . The Company has adopted Indian Accounting Standards ('Ind AS'), prescribed under Section 133 of the Companies Act, 2013 read with the relevant rules issued thereunder, with effect from April 01, 2020 and accordingly these financial results have been prepared in accordance with Ind AS notified under the Companies (Indian Accounting Standards) Rule, 2015 as amended by the Companies (Indian Accounting Standards) (Amendments) Rules 2016. The Financial results, presented in accordance with Ind AS 101 - First Time adoption of Indian Accounting Standards.
- The above results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at their meeting held on May 30, 2022, same were audited by the Statutory Auditor, who have issued an un-modified report thereon.

Previous periods figures have been regrouped and rearranged wherever necessary.

The above is an extract of the detailed format of Quarterly/Period Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly/Period Financial Results are available on the websites of Stock Exchange www.bseindia.com and the Company www.meeraind.com

For MEERA INDUSTRIES LIMITED

**Dharmesh Desai** Date: May 30, 2022 (Chairman & Managing Director) Place: North Carolina, USA



Moti Daman Branch, Opp. Hathi Baug, Moti Daman, Daman - 396220. Phone: 91 260 2230011. Email: motida@ban

SALE NOTICE FOR SALE OF IMMOVABLE PROPERTIES "APPENDIX- IV-A [See proviso to Rule 6 (2) & 8 (6) uction Sale Notice for Sale of Immovable Assets under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of S rest Act, 2002 read with proviso to Rule 6 (2) & 8 (6) of the Security Interest (Enforcement) Rules, 2002. Notice is hereby give lic in general and in particular to the Borrower(s) and Guarantor(s) that the below described immovable property mortgaged/chai Secured Creditor, possession of which has been taken by the Authorised Officer of Bank of Baroda, Secured Creditor, will be sold o ree is", "As is what is", and "Whatever there is" "Without recourse basis" for recovery of below mentioned account(s. The de rower/s/Guarantor/s/Secured Asset/s/Dues/Reserve Price/e-Auction date & Time, EMD and Bid Increase Amount are mentioned bel

Name & Address of Borrower/s/ Guarantor/s	Give Short Description of the immovable Property with known encumbrances, if any	Reserve Price EMD Bid Increase Amount	Status of Possession (Constructive/ Physical)
M /s Sai Infrastructure and developers, Survey No. 105 / 1 / 1 / , Amli Fuvara, Opposite,	admeasuring 1322 sq . mtrs . in village account no . 949 and construction thereon and $\sigma$	on 85,53,000/-	Symboliic/ Physical
Silvassa , Dadra & Nagar	consisting of R. S. No. 28 / P Paiki within the village limits of Sarigam in GIDC Industi notified area of Sarigam Taluka Umbergaon , District Valsad and bounded as follows : E	rial 1,87,20,000/- ast EMD	Symboliic/ Physical
	New Survey No. 335/2/2/3 and construction on the ground floor admeasuring 93.37 sq. mtrs. a first floor admeasuring 71.42 sq. mtrs. in village Silvassa within the Union Territory of Dadra and Silvassa within the Union Territory of Silvassa within the Unio	93,28,000/- end EMD	Symboliic, Physical
	of Borrower/s/ Guarantor/s M /s Sai Infrastructure and developers , Survey No. 105 / 1 / 1 / , Amli Fuvara , Opposite , Gayatri Mandir , Amli , illvassa , Dadra & Nagar Haveli -396230 ;	of Borrower/s/ Guarantor/s  M/s Sai Infrastructure 1. All that piece and parcel of House No. 1434 named as "Hill Resort", on Plot No. 0. 105 / 1 / 1 /, Amli Fuvara , Opposite , Gayatri Mandir , Amli , illvassa , Dadra & Nagar Haveli -396230;  All that piece and parcel of House No. 1434 named as "Hill Resort", on Plot No. 0. 105 / 2 / 11 / 3 admeasuring 1322 sq. mtrs . in village account no. 949 and construction thereon and control and bearing New Survey No. 2392 (Old Survey No. 203 / 2 / P14 ) of village Sarigam Taluka Umbergaon , District Valsad and bounded as follows: 2 at 18 that piece and parcel of industrial Plot No. 1233 admeasuring 1560 sq. mtr onsisting of R. S. No. 28 / P Paiki within the village limits of Sarigam in GIDC Indust notified area of Sarigam Taluka Umbergaon , District Valsad and bounded as follows: 2 30.00 mt. Main GIDC Road, North: Plot No. 1234, West: 50 Mt. U.C., South: Plot No. 1234, West: 50 Mt. U.C	Guarantor/s  M /s Sai Infrastructure and percel of House No. 1434 named as "Hill Resort", on Plot No. 08 and developers , Survey No. 105 / 1 / 1 /, Amli Fuvara , Opposite , Gayatri Mandir , Amli Taluka Umbergaon , District Valsad and bounded as follows: East : Road, West : 5 Survey No. 239 ( Old Survey No. 203 / 2 / P14 ) of village Sarigam , Taluka Umbergaon , District Valsad and bounded as follows: East : Road, West : 5 Survey No. 239 ( North : Common Plot , South : Plot No. 7, 2 . All that piece and parcel of industrial Plot No. 1233 admeasuring 1560 sq . mtrs . in village are of Sarigam Taluka Umbergaon , District Valsad and bounded as follows: East : Road, West : 50 Mt. U.C., South : Plot No. 1234

## ate & Time of E Auction:05.07.2022, Time 2 PM to 6 PM Property inspection date and Time: 01.07.2022, Time 12 PM to 4 PM

30 days statutory sale notice to Borrower/Guarantor/Mortgagor.
For detailed terms and conditions of sale, please refer to the link provided in https://www.bankofbaroda.in/and https://ibapi.in. Also, prospective bidders may contact the authorized officer on Mobile-9687680763 (Ram Naresh Yadav) AGM & AUTHORISED OFFICER

## RAJKOT INVESTMENT TRUST LIMITED

(CIN: L65910GJ1982PLC005301)

Registered Office: 229 Star Chambers Harihar Chowk, Rajkot, Gujarat 360001 E-mail id: rajkotitltd@gmail.com | Website: www.ritl.co.in Extract of Standalone Audited Financial Results for the Quarter and Year Ended M

arch 31, 2022 (Rs. in lacs Quarter Ended Year Ended **Particulars** 31.03.2022 | 31.12.2021 | 31.03.2021 | 31.03.2022 | 31.03.2021 (Audited) (Audited) (Unaudited) (Audited) (Audited 45.64 Total income from operations (net) 11.05 11.53 19.72 53.88 Net Profit / (Loss) for the period (before Tax. Exceptional and/or Extraordinary items) (3.44)9.15 (3.83)9.03 1.37 Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items) (3.83)4.74 (3.57)(3.44)9.15 Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items) (10.06)(6.58)(1.89)(6.32)9.15 Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)] (10.06)9.15 (6.58)(1.89)(6.32)**Equity Share Capital** 100.00 100.00 100.00 100.00 100.00 Reserves (excluding Revaluation Reserve as shown in the Balance Sheet of previous year) 350.38 352.28 Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations) Basic: (1.01)0.92 (0.66)(0.19)(0.63)

Note: The above is an extract of the detailed format of Financial Results for the Quarter and Year ended on 31st March, 2022 filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the website of the Company i.e. www.ritl.co.in and on the website of BSE Ltd www.bseindia.com) For, RAJKOT INVESTMENT TRUST LIMITED

(1.01)

0.92

SHRIKRISHNA BABURAM PANDEY DIRECTOR

(0.66)

(0.63)

(0.19)

(**DIN**: 07035767)

Date: 31.05.2022 Place: Ahmedabad

Diluted:

SBI

# STATE BANK OF INDIA

Stressed Assets Recovery Branch (SARB)
1st Floor, Ratna Artemus, 42, Sardar Patel Nagar, Nr Girish Cold Drinks Cross Road, Off C.G. Road, Ellisbridge, Ahmedabad - 380006 Publication of Notice regarding Physical Possession of property u/s 13(4) of SARFAESI Act 2002

Notice is hereby given under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Securit Interest Act, 2002 (54 of 2002) and in exercise of powers conferred under section 13 (12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002, a demand notice was issued on the dates mentioned against each accoun

and stated hereinafter calling upon them to repay the amount within 60 days from the date of receipt of said notice The Borrower having failed to repay the amount, notice is hereby given to the Borrower and the public in general that the undersigned has taken **Physical Possession** of the property described herein below in exercise of power conferred on him/her under section 13(4) of the said Act read with Rule 8 of the said Act on the dates mentioned against

The Borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealing with the property will be subject to the charge of the STATE BANK OF INDIA for an amount and interest thereon. The borrowers' attention is invited to provisions of Sub-section (8) of Section 13 of the Act, in respect of time available Name of **Description of the** Date of **Amount** 

Name of Account Proprietor/ Partners/ Property mortgaged/ (in Rs) charged Guarantors/ Owner of property etc. address Rs. E.M. over All that piece and Mr. parcel of the constructed property situated at Flat No. J-702, 7th Floor, "Samor Residency" admeasuring 58.62 sq.mtrs.,Near Devi Mata Mandir, B/h Om Shanti Nagar, Cannal Road,Vatva,Ahmedabad. T.P.S. No. 79 (Vatva), F.P.No. 61/3, Survey No. 41/1, 41/3/2, 41/2. Mouje: Vatva, Taluka: Aslali, District: Ahmedabad.bounded as By North: Flat No. J-703 By South: Society Road By East: Flat No. J-701 By West: Flat No. I-703 Sandi Mr. Sandip Jayantibhai Chauhan and (Rupees Twenty One Lakh Eighty Jayantibha Chauhan 25.02.2022 27.05.2022 and Mrs Mrs. Anandibe Six Thousand Two Hundred R Limbachiya Ninty Nine Only including accrued imbachiya interest of Rs. 9,144.00) 25.02.2022

Date: 27.05.2022 Authorised Officer State Bank of India Place: Ahmedabad



Regd. Office: Baroda - Godhra Highway, Kalol, District Panchmaha Pin Code - 389 330, Gujarat. • Tel: 02676 - 270600 • Fax: 02676 -235524 Website: www. setcoauto.com • Email: investor.relations@setcoauto.com CIN.: U35100GJ2010PTC062770

Extract of Standalone Unaudited / Audited Financial Results for the Quarter and Year ended March 31, 2022

						₹ in lakhs
Sr. No.	Particulars		Quarter Ended			Ended
		31-Mar-22	31-Dec-21	31-Mar-21	31-Mar-22	31-Mar-21
		Unaudited	Unaudited	Unaudited	Audited	Audited
1	Total Income from Operations	13,777	10,254	-	26,315	-
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	(1,532)	(3,132)	(0)	(6,618)	(0)
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	(1,575)	(3,132)	(0)	(17,436)	(0)
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	(1,439)	(3,132)	(0)	(17,300)	(0)
5	Total Comprehensive Income for the period [Comprising Profit/ (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	(1,485)	(3,132)	(0)	(17,347)	(0)
6	Paid-up Equity Share Capital (F.V. of ₹ 10/- each)	87	87	1	87	1
7	Reserves (excluding Revaluation Reserve) *	(25,612)	(24,127)	(3)	(25,612)	(3)
8	Securities Premium Account	4,962	4,962	-	4,962	-
9	Net worth	(25,524)	(24,040)	(2)	(25,524)	(2)
10	Paid up Debt Capital/ Outstanding Debt	56,522	56,522		56,522	-
11	Outstanding Redeemable Preference Shares	-	-	-	-	-
12	Debt Equity Ratio	-2.53	-2.60	-0.47	-2.53	-0.47
13	Earnings Per Share (F.V. of ₹ 10/- each)					
	Basic Diluted	-223.00 -187.22	-549.11 -472.74	-1.50 -1.50	-2,681.35 -2,251.17	-1.50 -1.50
14	Capital Redemption Reserve	-	-	-	-	-
15	Debenture Redemption Reserve	-	-	-	-	-
16	Debt Service Coverage Ratio	0.479	0.004	-	0.080	-
17	Interest Service Coverage Ratio	0.530	0.004	-	0.089	-

icludes of  $\stackrel{>}{ au}$  -13,224 lakhs of Slump Sale Adjustment Deficit Account

Notes:

- 1) The Financial Results for the quarter and year ended March 31, 2022 have been reviewed by Audit Committee and approved by the Board of Directors at its meeting held on May 30, 2022.
- 2) The above is an extract of the detailed format of quarter and year ended financial results filed with the Stock Exchanges under Regulation 52 of the LODR Regulations. The full format of the quater and year ended financial results are available on the websites of the Stock Exchange(s) (www.bseindia.com) and the Company's website (www.setcoauto.com).

B) For the other line Items referred in Regulation 52(4) of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations 2015, pertinent disclosures have been made to the BSE Limited and can be accessed on www.bseindia.com.

For and on behalf of the Board Harish Sheth **Chairman and Managing Director** 

DIN:01434459

Ahmedabad







Place: Kalol

Date: May 30, 2022



# ડિમાન્ડ નોટીસ (સરફેસી એક્ટ, 2002ના સેક્શન 13ના સબ સેક્શન (2) અંતર્ગત)

રેફ. 05381/13(2)/053830100019476/R J Bobbin | સ્થળ : સુરત

1. મેસર્સ આર જે બોબીન (કરજદાર) (શ્રી પરેશભાઈ ભવનભાઈ જશોલિયાની માલીકીની પેઢી) ... ગદારા આર જ ગાળાળ (ઝરજદાર) (સ્ત્રા પરશભાઇ ભવનભાઇ જશાલિયાના માલીકોની પઢી) પ્લોટ નં. 85, બીજો માળ, સુખરામ દેક્ષટાઈલ પાર્ક, ઓમ દેક્ષટાઈલ પાર્ક પાસે, ગામ પરબ , તા.કામરેજ સુરત-ગુજરાત-394225.

2. શ્રી પરેશભાઈ ભવનભાઈ જશોલિયા (કરજદાર) A-601, આદિત્ય રેસીડેન્સી, મોતી નગર પાસે, નાના વરાછા, સુરત-395006. **અને** પ્લોટ નં.3 , રોચલ વિલા , મોરથાણા , તા કામરેજ , જી.સુર

**અને** c/o જેલ સુપરીન્ટેન્ડન્ટ , લાજપોર સેન્ટ્રલ જેલ , જુનો સુરત-મુંબઈ હાઈવે , લાજપોર , સુરત-394235. 3. શ્રીમતી શોભા બેન (તે સ્વ હિરેનભાઇ જમનાભાઇ રાનપરિયાના પત્ની અને કાનૂની વારસદાર અને માસ્ટર રિયાન અને કુમારી માહીના માતા અને ગાર્ડીયન, સ્વ હિરેનભાઇ જમનાભાઇ રાનપરિયાના

E-302 , સ્ટર્લિંગ એવન્યુ , અલથાણ ગાર્ડન પાસે , સુરત-ગુજરાત-395007 .

4. શ્રીમતી અમિષાબેન જાજ્ઞેશભાઈ જશોલિયા (જામીનદાર)

.-601, આદિત્ય રેસીડેન્સી, મોતી નગર પાસે, નાના વરાછા, સુરત-ગુજરાત-395006.

5. શ્રી જીજોશભાઈ ભવનભાઈ જશોલિયા (જામીનદાર) A-601, આદિત્ય રેસીડેન્સી, મોતી નગર પાસે , નાના વરાછા, સુરત-ગુજરાત-395006. અને C/o જેલ સુપરીન્ટેન્ડન્ટ, લાજપોર સેન્ટ્રલ જેલ , જુનો સુરત-મુંબઈ હાઈવે , લાજપોર , સુરત-394235. 6. શ્રી હિરાભાઈ ગોરધનભાઈ કાકડીયા (જામીનદાર)

9, હરિકુંજ સોસાયટી, નાના વરાછા, ચિકુવાડી, સુરત-ગુજરાત-395006.

સાહેબ/મેડમ

વિષય : અમારી શાખામાંથી આપવામાં આવેલી ક્રેડિટ સુવિદ્યાઓ સંદર્ભે એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યુરીટી ઈન્ટરેસ્ટ દ્વારા કાર્ચવાઢી નોટીસ પાઠવવામાં આવી .એનપીએ તરીકે વર્ગીકૃત જાહેર કરેલ છે . સરફેસી એક્ટ , 2002 ਗ 13 (2) ਅધਿનિયમ હેઠળની 01-01-2022 ਗੀ ਤਿਸਾਵਤ ਗੇਟਿસ અને ઉપરોક્ત નોટિસના અનુસંઘાનમાં લેવાચેલી અન્ય તમામ ક્રિયાઓ , એક્ટ હેઠળ , જો કોઈ હોય તો , અમે આથી આ નોટિસને ચાદ કરીએ છીએ .

અમે આપને જણાવીએ છોએ કે આપનું એકાઉન્ટ **મેસર્સ આર જે બોળીન**ને બાકી ચુકવણી/હપ્તા/વ્યાજની ચુકવણી કરવામાં નિષ્ફળ થયાં અને જેને અનુલક્ષીને તા. 17-12-2021 ના રોજ એનપીએ ખાતા તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું છે, તા. 17-12-2021 ના રોજ બાકી રકમ રૂા. 1,98,60,144.97 (રૂપિયા એક કરોડ અદાણું લાખ સાઇઠ હજાર એક સો ચુંમ્માલીસ રૂપિયા અને સત્તાણું પૈસા પૂરા) તા. 29-11-2021ના રોજથી લાગુ વ્યાજ બાકી છે જે નીચે મુજબ છે

સુવિધાનો પ્રકાર	એકાઉન્ટ નંબર	મંજુર લોન (રૂપિયામાં)	व्याજनो हर	કુલ બાકી (તા. 29-11-2021 સુધીના વ્યાજ સહિત)(રૂપિયામાં)
ટર્મ લોન	053830100019476	1,92,00,000.00	9.95%	इ। . 1 ,61 ,79 ,128 .97
UGECL	053830100020311	38,50,000.00	7.50%	इ। . 36 ,81 ,016 .00
		કુલ બાકી રકમ		इ।. 1,98,60,144.97

અમારી વારવારની માંગણીઓ છતાં ન તો તમે, નં. 1 અને 2 લેનારા છો કે ન તો તમે, નંબર 4 થી 6 બાંચદ્યરી આપનાર હોવાના કારણે ખાતામાં બાકી રહેલ રકમ માટે કલ રકમ ચકવવામાં નિષ્કળ ગયા હત અને કરાર આદ્યારિત જવાબદારીઓનું નિકાલ કરવામાં અવગણના કરવામાં આવી હતી અને ડિફોલ્ટ થઇ

અત્રે ઉલ્લેખનીય છે કે, ઉપરોક્ત સુવિધાઓમાં બેંકને બાકી લેણાંની ચુકવણી માટે સ્વ. હિરેનભાઈ જમનાભાઈ રાનપરિયા દ્વારા તા. 18-10-2019ના રોજ સામાન્ય ફોર્મની ગેરટીનો અમલ કરીને રૂા. 1,92,00,000/- (રૂપિયા એક કરોડ બાયુ લાખ પુરા)ની રકમની બાયઘરી આપવામાં આવી હતી, અને આગળ તાં. 04-07-2020ના રોજ ગેરંટી પત્રનો અમલ કરીને રૂા. 38 ,50 ,000/-( રૂપિયા આડગ્રીસ લાખ પચાસ હજાર પૂરા )ની રકમની બાંચધરી આપવામાં આવી હતી .

બેંકને જાણવા મળ્યું છે <del>કે</del> શ્રી હિરેનભાઈ જમાનાભાઈ રાનપરિયાનું તાજેતરમાં જ અવસાન થયું છે. તમે નંબર 3 , મૃતક બાંચેઘરી આપનાર હિરેનભાઇ જમાનાભાઇ રાનપરિયાના કાયદેસરના વારસંઘર તરીકે સ્વ . શ્રી હિરેનભાઇ જમાનાભાઇ રાનપરિયાના વ્યવસાય અને સીક્યુરીટીઓ વારસામાં મેળવી છે . તેથી , તમે , નં . 3 , શ્રી હિરેનભાઈ જમનાભાઈ રાનપરિયાના કાયદેસરના વારસદાર તરીકે , તમારી સાથે , નંબર 1. 2. 4. 5 અને 6 શ્રી હિરેનભાઈ જમનાભાઈ રાનપરિયા દ્વારા મેળવેલી ઉપરોક્ત જવાબદારીઓ અને બાકી લેણાં ને ડિસ્ચાર્જ કરવા માટે જવાબદાર છો .

આથી તમોને સિક્યુરીટાઈઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ફાઈનાન્સીયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યુરીટી ઈન્ટરેસ્ટ એક્ટ , 2002ના સેક્શન 13(2) હેઠળ રૂા.1,98,60,144.97 **(રૂપિયા એ**ક કરોડ અક્ષણું લાખ સાઈઠ હજાર એક સો ચુંમ્માલીસ રૂપિયા અને સત્તાણું પૈસા પૂરા) તા. 30-11-2021 થી કવર ન થયેલ વ્યાજ (જો હોય તો), કોસ્ટ, ખર્ચાઓ અને આગળનું વ્યાજ જે માસિક બાકી/તમારા દ્વારા થયેલા કરારબદ્ધ શરતો અને વિગતો મુજબ છે. જે આ નોટીસ પ્રસિદ્ધ થયેથી 60 દિવસમાં તમામ બાકી લેણાં ભરપાઈ કરી દેવા , જો આમ કરવામાં નિષ્ફળ જશો તો અમે નીચે જણાવેલી મિલકતને બેંકની તરફેણમાં તથા જણાવેલ કાચદાઓ હેઠળના તમામ હક્કો દ્વારા અમલમાં મુકવા માટે ફરજ પાડીશું

#### મિલકતની વિગત

1. તમામ ભાગ અને હિસ્સા સિહત પ્લોટ નં.3, અંદાજીત માપ 763.04 ચો.મી., "રોચલ વિલા", બિન ખેતીલાથક જમીનનો ભાગ , રેવન્થુ સર્વે નં. 272 , 435/2+3+4 એટલે કે નવો રેવન્થુ સર્વે નં. 208, બ્લોક નં.238, ગામ મોરથાણા, તાં.કામરેજ, જુ. સુરત. જેની ચતુર્સિમા : ઉત્તર : લાંગુ સોસાચટીનો આંતરિક રસ્તો, દક્ષિણ : બ્લોક નં. 236, પૂર્વ : બ્લોક નં. 243, પશ્ચિમ : પ્લોટ નં.4. જે મિલકત શ્રી પરેશભાઈ ભવનભાઈ જશોલિયા (કરજદાર) (મેસર્સ આર જે બોબીનના માલિક)ના નામે સ્થિત છે. 2. બોબિન વાઈન્ડર મસીન 70 સેટ, મલ્ટી હેડ એમ્બ્રોઈડરી મશીન સ્પેર પાર્ટસ અને એસેસરીઝ સાથે. ૧ે મેસર્સ આર જે બોબિન(કરજદાર)( શ્રી પરેશભાઈ ભવનભાઈ જશોલિયા ની માલિકીની પેઢી)

।) મહેરબાની કરી નોંધ લેશો કે જો તમે 60 દિવસમાં આ રકમ ભરપાઈ કરવામાં નિષ્ફળ ગયા તો , બેંક કાયદાના તમામ હક્કો હેઠળ પગલા લઈ જો સુરક્ષિત અક્સ્થામતોનું વેચાણ દ્વારા પણ બાકી લેણ સંતોષકારક રીતે ન ભરપાઈ થયા તો અમોને તમારી પાસેથી બાકીની રકમ ની વસુલી માટે તમારી સાથે કોર્ચના કાયદા/ડેબ્ટ રીકવરી ટ્રીબ્યુનલ કાયદાકીય પગલા લેવાની ફરજ પડશે. 2) તમને વિનંતી કરવામાં આવે છે કે કલમ 13(13) કાયદા હેઠળ , આ નોટીસ મળ્યા બાદ બેંકની જણ બહાર અહીં જણાવેલ મિલફતનો ફક્ત દંધાના સામાન્ય કામકાજ માટેના ઉપયોગ સિવાય આ

મિલકતનો નિકાલ અથવા વેચાણ કરી શકશો નહીં. નોંધ લેશો કે આ કાયદાના ઉલ્લંઘન કરશો તો ગંભીર પરિણામ ભોગવવું પડશે .

) તમને જણાવવામાં આવે છે આ નોટીસનું ધ્યાન આકૃષ્ટ કરવામાં આવે છે તે જણાવેલ સમય મર્ચાદામ સેક્શન 13ના સબ સેક્શન (8) હેઠળ તેમો તમારી સુરક્ષિત મિલકતની બાકી લેણા ભરપાઈ કરી પાછી આપનો વિશ્વાસુ, ફ્રાન્સીસ એલ. ફર્નાન્ડીઝ મુખ્ય પ્રબંધક, અધિકૃત અધિકારી તા. 24-05-2022 | સ્થળ : સુરત

લેતાં બેંકમાં ગીરો/ચાર્જમાં મૂકેલી સ્થાવર સંપત્તિની હરાજી દ્વારા વેચાણ અંગેની નોટિસ.

મિલકતની રિઝર્વ કિંમત રૂ. ૨૩, ૧૦, ૦૦૦/- અને અર્નેસ્ટ મની ડિપોઝીટ રૂ. ૨, ૩૧, ૦૦૦/- રહેશે.

હરાજી વેચાણની તારીખ અને સમય ૦૯.૦૯.૨૦૨૨ સવારે ૧૧.૩૦ વાગે

તમિલનાડ મર્કન્ટાઈલ બેંક લિમિટેડ,

રીંગરોડ શાખા, સુરત-૩૯૫૦૦૨, ગુજરાત

Tamilnad Mercantile Bank Ltd

CIN - U65110TN1921PLC001908

હરાઊનું સ્થળ

भिલકतनी विगत :

તમિલનાડ મર્કેન્ટાઇલ બેંક લીમીટેડ

કિજ્ઞરી સીનેમા, રીંગરોડ શાખા, સુરત-૩૯૫૦૦૨, ગુજરાત

[ જુઓ નિયમો ૮(૬) ]

હરાજી વેચાણ નોટિસ સ્થાવર મિલ્કતો માટે

સિક્યુરિટાઈગ્રેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન ઓફ ફાઈનાલ્સિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યુરિટી ઈન્ટરેસ્ટ એક્ટ

૨૦૦૨ સાથે સિક્યુરિટી ઈન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) અધિનિયમ, ૨૦૦૨ની ક્લમ ૮ (૬) અને ૯ (૧) ની જોગવાઈઓને વંચાણે

આથી જાહેર જનતાને જણાવવાનું કે, નીચે દર્શાવેલ કરજદાર/જામીનદારની સ્થાવર મિલકત જે ગીરો/ચાર્જ તરીકે મુકેલા સુરક્ષીત

મીલકતનો રચનાત્મક કબજો તામિલનાડ મર્કન્ટાઈલ બેંક રીંગરોડ શાખા (સુરક્ષિત લેણદાર)નાં અધિકૃત અધિકારીએ લીધો છે; જેનુ

વેચાણ ''જ્યાં છે, જેમ છે'', ''જ્યાં છે જે છે'' અને ''જ્યાં પણ જે કંઈપણ છે''ના આધાર પર સદર નીચે દર્શાવેલી તારીખ

પૈસા પુરા) તા. ૩૦-૦૪-૨૦૨૨ મુજબ (કેશ ક્રેડિટ રૂા. ૬૨,૫૪૦,૭૩.૭૫ તા. ૩૦-૦૪-૨૦૨૨ મુજબ અને ટર્મ લોન જીઈસીએલ રા. ૧૧,૭૫,૩૫૧.૧૭ તા. ૩૦-૦૪-૨૦૨૨) બાકી નીકળતા ખર્ચ જે તામિલનાડુ મર્કન્ટાઇલ બેંક લિમિટેડ, રીંગરોડ

શાખા (સુરક્ષિત લેણદાર) મેસર્સ ઈશાવ્યા કોર્પોરેશન પ્રાઈવેટ લિમિટેડ, ડીરેક્ટર/જામીનદાર : શ્રી કાથરોટીયા પીયુષ પોપટભાઈ,

જે પોપટભાઈ કાથરોટીયાના પુત્ર અને ડીરેક્ટર/જામીનદાર : શ્રીમતી કાથરોટીયા નિશા પિયુષ જે કાથરોટીયા પીયુષ

પોપટભાઇના પત્ની મિલકત નં. ૧ : મિલકતની રિઝર્વ કિંમત રૂ.૨૩,૧૦,૦૦૦/- અને અર્નેસ્ટ મની ડિપોઝીટ રૂ.૨,૩૧,૦૦૦/-,

મિલકત નં. ૨: મિલકતની રિઝર્વ કિંમત રૂ.૨૩,૧૦,૦૦૦/- અને અર્નેસ્ટ મની ડિપોઝીટ રૂ.૨,૩૧,૦૦૦/-, મિલકત નં. ૩:

પ્લોટ નં. ૨૫/સી, ૨૫/ડી અને ૨૫/ઈ ગ્રાઉન્ડ ફ્લોર, અનિમેશ હાઉસ, કિજ્ઞરી સીનેમા,

ย-มิย์ด : surat\_ringroad@tmbank.in, รูโด : ๐२५१- २३५५५๐๐, २३५७५००

૧. સમાન ગીરો ના અવિભાજિત પ્રમાણસર હિસ્સા ની જમીન ક્ષેત્રફળ ૩૩૦.૦૦ ચો.ફૂટ અથવા

૩૦.૬૭ ચો.મી. જેનો બિલ્ડ અપ એરિયા અને ૨૭૫.૦૦ ચો.મી. અથવા ૨૫.૫૬ ચો.મી.

કાર્પેટ એરિયા, ઓફિસ નં. ૪૦૪, રાઇઝ ઓન પ્લાઝા, ૪થા માળે, રાજહંસ સ્વપ્રની સામે,

આર.એસ. નં. ૧૪૭, બ્લોક નં.૧૪૪/બી, બ્લોક નં.૧૪૪/બી/૨, ૭/૧૨ મુજબ, ટી.પી.એસ. નં.૨૧ ( સરથાણા-સિમડા), ફાઈનલ પ્લોટ નં. ૫૮/૧ સબ પ્લોટ નં.૨, સરથાણા નેચર પાર્ક પાસે, સરથાણા-જકાતનાકા, સુરત-કામરેજ રોડ, ગામ-સરથાણા, તા. કામરેજ (પુના), સુરત ખાતે આવેલા છે. જેની માલીકી શ્રી પિયુષ પોપટભાઈ કથારોટીયાના નામે છે. જેની ચતુર્સીમા ઉત્તરઃ પેસેજ, દક્ષિણઃ સંલગ્ન મિલકતા, પૂર્વઃ ઓફિસ નં. ૪૦૩, પશ્ચિમઃ ઓફિસ નં. ૪૦૫ ૨. સમાન ગીરો ના અવિભાજિત પ્રમાણસર હિસ્સા ની જમીન ક્ષેત્રફળ ૩૩૦.૦૦ ચો.ફૂટ અથવા ૩૦.૬૭ ચો.મી. જેનો બિલ્ડ અપ એરિયા અને ૨૭૫.૦૦ ચો.મી. અથવા ૨૫.૫૬ ચો.મી. કાર્પેટ એરિયા, ઓફિસ નં. ૪૦૫, રાઇઝ ઓન પ્લાઝા, ૪થા માળે, રાજહંસ સ્વપ્રની સામે, આર.એસ. નં. ૧૪૭, બ્લોક નં.૧૪૪/બી, બ્લોક નં.૧૪૪/બી/૨, ૭/૧૨ મુજબ, ટી.પી.એસ.

૦૭.૦૭.૨૦૨૨ નીચે દર્શાવેલ રૂા.૭૪,૨૯,૪૨૪.૯૨ (અંકે રૂપિયા ચુમ્બોતેર લાખ ઓગણત્રીસ હજાર ચારસો ચોવીસ અને બાણું

પ્લોટ નં. ૨૫/સી, ૨૫/કી અને ૨૫/ઈ ગ્રાઉન્ડ ફ્લોર, અનિમેશ હાઉસ,

ย-มิย์ต : surat\_ringroad@tmbank.in, อโต : ๐२۶٩- २३۶۶५๐๐, २३۶७۶๐๐

પોલીસે

આજે સવારે ૯ 🗕

# સુરત સિવિલ હોસ્પિ.ના ટ્રોમા સેન્ટરના ટોયલેટમાંથી મૃત બાળકીનું ભૂણ મળ્યું સુરત, મા. ૩૧ કરતા છ માસના બાલકીનું ભૂણ હોલોનું

શહેરના મજુરાગેટ નજીક આવેલી જાણવા મળ્યું હતુ. હોસ્પિટલમાંથી મળી નવી સિવિલ હોસ્પિટલ-ટ્રોમા સેન્ટરમાં આવેલા ભ્રુણ અંગે ખટોદરા પોલીસને ટોયલેટમાંથી આજે સવારે એક બાળકીનું જાણ કરવામાં આવી હતી.પોલીસે ભૃષ્ા મળી આવતા ચકચાર મચી ગઈ સ્થળ ઉપર પહોંચી હતી અને તપાસ

હતી.ઘટનાને પગલે ડોકટરો તેમજ શરૂ કરી હતી. આ અંગે પીએસઆઇ બી.એમ. સ્ટાફ ત્યાં દોડી ગયા હતા.ત્યાર બાદ ભૃષ્મને બહાર કાઢવા આવ્યો હતો તેમજ દેસાઈએ જણાવ્યું હતું કે ગાયનેક રિલેટેડ ખટોદરા પોલીસને જાણ કરવામાં આવી પ્રોબ્લેમ સાથે કોઈ મહિલા અહીં આવી

ૈહશે, ત્યારે તેમને ાટોદરા સીસી **બદનામીથી બચવા છ** ત્યાં જ પ્રસુતિ ટીવીના આધારે તપાસ શરૂ કરવામાં આવી રહી છે. કરી દેવાયાની ચર્ચા ગભરાઇને કોઈને

થી ૯.૩૦ કલાકના સમયગાળા વચ્ચે કર્યા વગર ત્યાંથી ચાલી ગઈ હોય તેવું ટ્રોમા સેન્ટરના ટૉઈલેટમા સર્વેન્ટ સફાઈ હાલમાં લાગે છે. જો કે એક વાત એવી કરવા માટે ગયો હતો, ત્યારે અંદર મૃત ચર્ચાય રહી છે, કોઇ મહિલાએ પોતાનું ભ્રુણ જોઈને ચોકી ઉઠ્યો હતો, અને પામ છુપાવવા માટે ભૃણને ટોયલેટમાં ગંભરાયને બહાર દોડી આવીને ડોકટર ફેંકી દોંધુ હોય, સમગ્ર બનાવ અંગે સહિત સ્ટાફને આ બાબતે જાણ કરી સીસી ટીવીના આધારે હોસ્પિટલમાં હતી. એ પછી ડોક્ટર તેમજ નર્સ સહીત આવેલી શંકાસ્પદ વ્યક્તિઓને ચેક સ્ટાફ ત્યાં પહોંચ્યો હતો. તેઓએ તપાસ કરવામાં આવી રહ્યા છે.

# વિપૂક્ષ મયોદા ચૂક્યોઃ અવસાન પામેલા ભાજપના કોર્પોરેટર જયેશ જરીવાલાને શ્રદ્ધાંજુલિ પાઠવી નહી

સભા

મહાનગરપાલિકાના ઉણા ઉતર્યા. સ્વ. જયેશ જરીવાલા કોઈ ભાજપના કોર્પોરેટર જયેશ જરીવાલાનું પણ પક્ષ સાથે સંકળાયેલા હોય પણ ગત ૨૨ મેના રોજ હાર્ટ એટેકથી દુખદ તેઓ એક કોર્પોરેટર હતા, પક્ષાપક્ષીની અવસાન થયું હતું. સીટીંગ કોર્પોરેટરના વાત બાજુ પર મુકીએ તો પણ તેઓ મનપાની ચૂંટાયેલ

આજે અને ૭૧ સભ્યો ૧૫ હજાર મળી છતાં આપમાંથી વિવેક ન મનપા સામાન્ય સ્વૈચ્છાએ ૧૬.૯૦ **લાખનો ફાળો** દાખવ્યો. આ સાથે (મનપા મળેલી ાનપા સ્વ. **જરીવાલા પરિવારને આપશે** ૯૬ સભ્યો પૈકી બોર્ડ)માં જયેશ જરીવાલાને 🗕

સહીતના પદાધિકારીઓએ સ્વ. આપના સભ્યો કે વિપક્ષી નેતા તરફથી જયેશ જરીવાલાને શ્રધ્ધાંજલિ પાઠવી આવો કોઈ વિચાર પ્રદર્શિત થયો નેથી હતી. આ સાથે જયેશ જરીવાલાની જ જ્ઞાતિના હોવાથી રેશ્મા લાપસીવાલાએ, સ્લમ ઈમ્પ્રુવમેન્ટ કમિટીના તેઓ વાઈસ ચેરમેન હતા, એટલે ચેરમેન દિનેશ પુરોહિતે તથા ગેમર દેસાઈ સહીતનાએ શ્રધ્ધાંજલિ પાઠવી પરંતુ વિપક્ષ નેતા અને આપના

કોર્પોરેટરો મૃત્યુનો મલાજો જાળવીને

પદાધિકારીઓ શ્રધ્ધાંજલિ પાઠવી, બે મિનીટના સહિતના ૨૫ સભ્યોએ ૨૫-૨૫ હજાર મૌન બાદ સભા મુલતવી રાખવામાં અને અન્ય ૭૧ સભ્યોએ ૧૫-૧૫ આવી હતી. મેયર, ડે. મેયર, હજાર તેઓના પરિવારને આપવાનું સ્ટેન્ડિંગ ચેરમેન, શાસક પક્ષ નેતા પણ નક્કી કર્યું છે. આ મુદ્દે પણ

TAMILINAD
Mercantile
Bank Ltd

CIN - U65110TN1921PLC001908

यूको बैंक (UCO BANK) गंगेश्वर नगर धर्थापोर-३, हशरा रोऽ, સુરત-395418. ફોન : 0261-2841500, E-mail: hazira@ucobank.co.in

## डज्ञ नोटीस (सेड्शन १३(४))

ખાથી નીચે સહી કરનાર **યુકો બેંક**ના અધિકૃત અધિકારીશ્રીએ સિક્યોરીટાઈઝેશન એન્ડ રીકન્સ્ટ્રકશન ઓફ ફાઈનાન્સીયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યુરીટી ઈન્ટરેસ્ટ અધિનિયમ, 2002 (54 ઓફ 2002) (હવે એક્ટ તરીકે ઓળખાશે) તથા સિક્યુરીટી ઈન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, 2002ના નિયમ 3 સહિત કલમ 13(12) અંતર્ગત મળેલ સત્તાની રૂએ <mark>તા. 12-01-2022</mark>ના રોજ કરજદાર શ્રી પ્રવિણ**ભાઈ નારણભાઈ** ગોહિલ(કરજદાર અને મોર્ટગેજર), શ્રીમતી કુંવરબેન પ્રવિણભાઈ ગોહિલ(સહ-કરજદાર)ને ડિમાન્ડ નોટિસ પોઠવી હતી. સદર નોટીસમાં પોઠવેલી રકર્મે **રૂા.7,31,555.95(રૂપિયા સાત લાખ એકત્રી**સ હજાર પાંચ સો પંચાવન રૂપિયા અને પંચાણું પૈસા પૂરા ) તથા આગળનું વ્યાજે, આકસ્મિક ખર્ચાઓ અને કોસ્ટ નોટીસ પ્રાપ્તીની તારીખથી 60 દિવસની અંદર ચુકવી દેવાનું જણાવ્યું હતું.

કરજદાર સદરહુ રકમ પરત ચુકવવામાં નિષ્ફળ જતા કરજદાર અને જાહેર જનતાને આ સાથે નોટિસ ખાપવામાં આવે છે કે સહી કર<sup>ૅ</sup>નારે સદરહુ ઓર્ડીનેન્સ એક્ટની કલમ 13(4) અને સિક્યુરીટી ઈન્ટરેસ્ટ બેન્ફોર્સમેન્ટ નિયમ 2002ના નિયમ 8 સાથે વાંચતા મળેલી સત્તાની રૂએ અહીં નીચે જણાવેલી મિલકતનો

કબજો તા.26-05-2022નાદિને સંભાળી લીધેલ છે. ખહીં કરજદારનું ધ્યાન આકૃષ્ટ કરવામાં આવે છે કે , જણાવેલ સમય મર્યાદામાં સેક્શન 13ના સબ સેક્શન (8) હેઠળ તમો તમારી સુરક્ષિત મિલકતોને બાકી લેંજ્ઞા ભરપાઈ કરી પાછી મેળવી શકો છો .

કરજદાર અને જાહેર જનતાને આથી જાહેર ચેતવણી આપવામાં આવે છે કે, તેમણે સદરહુ મિલકત બાબતમાં કોઈ વ્યવહાર કરવો નહીં અને કોઈપણ **યુકો બેંક** માટે **રૂા.7,31,555.95** + વ્**યાજ અને અન્ય ચાર્જીસ** 

## ઃ સ્થાવર મિલકતનું વર્ણન ઃ

તમામ હક્ક, ટાઈટલ અને ઈન્ટરેસ્ટ, E ટાઈપ પ્લોટ નં.138, અંદાજીત માપ 60.28 ચો.મી., રસ્તા અને સીઓપીમાં અવિભાજીત હિસ્સા સાથે, "હરિ દર્શન રેસીડેન્સી", બ્લોક નં.18 (એક્ત્રીકરણ બ્લોક નં. 18 19, 20 વૈકી 1, 21 અને 27), ગામ શેખપુર, સબ ડિસ્ટ્રી. કામરેજ, જી. સુરત. જેની ચતુર્સિમા ઃ પૂર્વ્ આંતરિક રસ્તો, પશ્ચિમ: પ્લોટ નં. 155, ઉત્તર: પ્લોટ નં. 139, દક્ષિણ: પ્લોટ નં. 137.

તા. 26-05-2022 | સ્થળ : સુરત. અધિકૃત અધિકારી, યુકો બેંક, હજીરા શાખા, સુરત્

પંથ ઈન્ફીનીટી લીમીટેડ રજી. ઓફિસઃ ૧૦૧, સિઘ્ધ ચેમ્બર્સ, તરતીયા હનુમાન શેરી, ગુર્જર ફળીયા, હરીપુરા, સુરત-૩૯૫૦૦૩, ગુજરાત (CIN: L45201GJ1993PLC114416)

Tel: 7043999011, Email: info@panthinfinity.com, Website: www.panthinfinity.com 39 મી માર્ચ ૨૦૨૨ ના રોજ સમાપ્ત થયેલા ત્રીમાસીક અને વાર્ષિક સમયગાળાના અલાચદા ઓડીટેડ નાણાંકીય પરીણામોનો સાર

ક		પૂર	ા થતા ત્રીમાર	ક્ષીક	પૂરા થતા વર્ષનું		
й Н	વિગત	૩૧.૦૩.૨૦૨૨ (ઓડીટેડ)	૩૧.૧૨.૨૦૨૧ (અન-ઓડીટેડ)		૩૧.૦૩.૨૦૨૨ (ઓડીટેડ)	3૧.૦૩.૨૦૨૧ (ઓડીટેડ)	
٩	સંચાલન માંથી કુલ આવક (ચોષ્ખી)	366.44	206.96	9934.86	9846.66	2958.88	
5	સમયગાળા દરમિયાનનો ચોખ્ખો નફો / (ખોટ) (કરવેરા પહેલા, અપવાદીત અને / અથવા અસાધારણ વસ્તુઓ પહેલા)	-9.6Y	-8.84	-86.39	-0.00	6.58	
3	કરવેરા પહેલાના સમયગાળા દરમિયાનનો યોખ્ખો નફો / ખોટ (અપવાદીત અને / અથવા અસાધારણ વસ્તુઓ પછી)	-9.6Y	0.48	-20.39	4.99	30.06	
8	કરવેરા પછીના સમયગાળા દરમિયાનનો યોખ્ખો નફો / (ખોટ) (અપવાદીત અને / અથવા અસાધારણ વસ્તુઓ પછી)	-0.60	0.49	-98.96	8.50	55.64	
ч	સમયગાળાની કુલ વ્યાપક આવક (સમયગાળા દરમિયાનનો વ્યાપક નફો/(ખોટ) (કરવેરા પછી) અને અન્ય વ્યાપક આવક (કરવેરાપછી)	-८७.५٩	-9.36	-29.39	-65.58	35.05	
ç	ઈક્વીટી શેર કેપીટલ (પ્રતિ શેર રૂા.૧૦/– ની મૂળ કિંમત)	4535.40	9232.40	9535.40	9235.40	4535.40	
6	ભંડોળ (ગયા વર્ષની ઓડિટેડ પાકા સરવૈયા માં દર્શાવ્યા મુજબ પૂનઃમુલ્યાંકિત ભંડોળ બાદ કરતા)	0.00	0.00	0.00	4030.48	9025.55	
ć	શેર દીઠ આવક (પ્રત્યેક શેર રૂા.૧૦/– મુજબ) (સતત અને બંધ કામગીરી માટે) (અ) મૂળ પ્રેપીએસ	-0.09	0.00	-0.92	0.03	0.55	
	(બ) ભેગી ઈપીએસ	-0.09	0.00	-0.92	0.03	0.7	

નોંધ: ૧. સેલીના (લીસ્ટીંગ અને અન્ય જાહેરાતો માટે જરૂરી) નીયમ ૨૦૧૫ ની કલમ ૩૩ મુજબ સ્ટોક એશ્યેન્જોમાં આપવામાં આવેલ ૩૧.૦૩.૨૦૨૨ના ત્રીમાસીક અને વાર્ષીક નાણાંકીય પરિશામોનો હુંક સાર ઉપર આપવામાં આવ્યો છે. ત્રીમાસીક અને વાર્ષીક ઓડિટેડ નાણાંકિય પરિણામ કંપનીની વેબસાઈટ www.panthinfinity.com અને બોમ્બે સ્ટોક એક્ચેન્જની વેબસાઈટ એટલે કે www.bseindia.com. પર સંપુર્ણ અહેવાલ ઉપલબ્ધ છે

ઉપરોક્ત નાંણાકિય પરીણામોને ઓડિટ કમીટી દ્વારા ધ્યાને લેવામાં આવ્યા હતા અને તા.૩૦.૦૫.૨૦૨૨ ના રો૧ મળેલી બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મીટીંગમાં મંજુરી આપવામાં આવી હતી.

. ઉપરોક્ત નાણાકીય પરીણામો ઇન્ડીયન એકાઉન્ટીંગ સ્ટાન્ડર્ડ (આઈએનડીએએસ) ના કંપની એક્ટ ૨૦૧૩ ન કલમ ૧૩૩ તેના અંતર્ગત સૂચીત કાયદાઓ અને સુચનાઓ મુજબ તૈયાર કરવામાં આવ્યા છે. પંચ ઈન્ફીનીટી લીમીટેડ, વતી

સહી/-જીનચ કોરડીચા ચેરમેન એન્ડ મેનેજીંગ ડીરેક્ટર DIN: 03362317 સ્થળઃ સુરત

di:: 30.04.5055 તમિલનોફ મર્કેન્ટાઇલ બેંક લીમીટેડ રીંગરોડ શાખા

પ્લોટ નં. ૨૫/સી, ૨૫/ડી અને ૨૫/ઈ ગ્રાઉન્ડ ફ્લોર, અનિમેશ હાઉસ, ક્લિરી સીનેમા, રીંગરોડ શાખા, સુરત-૩૯૫૦૦૨, ગુજરાત ย-มิย์ด : surat\_ringroad@tmbank.in, รูโด : ๐२५१- २३५५५๐๐, २३५७५००

### [ જુઓ નિયમો ૮(૬) ] હરાજી વેચાણ નોટિસ સ્થાવર મિલ્કતો માટે

સિક્યુરિટાઈઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન ઓફ ફાઈનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યુરિટી ઈન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ સાથે સિક્યુરિટી ઈન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) અધિનિયમ, ૨૦૦૨ની કલમ ૮ (૬) અને ૯ (૧) ની જોગવાઈઓને વંચાણે લેતાં બેંકમાં ગીરો/ચાર્જમાં મૂકેલી સ્થાવર સંપત્તિની હરાજી દ્વારા વેચાણ અંગેની નોટિસ.

આથી જાહેર જનતાને જણાવવાનું કે, નીચે દર્શાવેલ કરજદાર/જામીનદારની સ્થાવર મિલકત જે ગીરો/ચાર્જ તરીકે મુકેલા સુરક્ષીત મીલકતનો રચનાત્મક કબજો તામિલનાડ મર્કન્ટાઈલ બેંક રીંગરોડ શાખા (સુરક્ષિત લેણદાર)નાં અધિકૃત અધિકારીએ લીધો છે; જેનું વેચાણ ''જ્યાં છે, જેમ છે'', ''જ્યાં છે જે છે'' અને ''જ્યાં પણ જે કંઈપણ છે''ના આધાર પર સદર નીચે દર્શાવેલી તારીખ ઃ ૨૧.૦૬.૨૦૨૨ નીચે દર્શાવેલ રૂા.૩૦,૬૬,૫૨૯.૭૯ (અંકે રૂપિયા ત્રીસ લાખ છાસઠ હજાર પાંચસો ઓગણત્રીસ અને ઓગણ્યાસી પૈસા પુરા) બાકી નીકળતા ખર્ચ જે તામિલનાડુ મર્કન્ટાઇલ બેંક લિમિટેડ, રીંગરોડ શાખા (સુરક્ષિત લેણદાર) **મેસર્સ મા ક્રિએશન, પ્રોપરાઇટર**ઃ **શ્રી સીતાપરા અશ્ચિ**ન વલ્લભભાઈ, જે વલ્લભભાઈ લવજીભાઈ સીતાપરાના પુત્ર અને જામીનદાર શ્રી હુમ્મર નરેશભાઈ ધીરુભાઈ, જે શ્રી. ધીરુભાઇ **મમાગભાઈ હસ્મરના પત્ર, મિલકતની રિઝર્વ કિંમત ૩,૩૨,૩૨,૦૦૦/-** અને અર્નેસ્ટ મની ડિપોઝીટ ૩,૩,૨૩,૨૦૦/- રહેશે

હકાશિવોં ક્લા	તમિલનાડ મર્કન્ટાઇલ બેંક લિમિટેડ, પ્લોટ નં. ૨૫/સી, ૨૫/ડી અને ૨૫/ઇ ગ્રાઉન્ડ ફ્લોર, અનિમેશ હાઉસ, ક્લિરી સીનેમા, રીંગરોડ શાખા, સુરત-૩૯૫૦૦૨, ગુજરાત ઇ-મેઇલ : surat_ringroad@tmbank.in, ફોન : ૦૨૬૧- ૨૩૬૬૫૦૦, ૨૩૬७૬૦૦
હરાજી વેચાણની તારીખ અને સમય	૨૧.૦૬.૨૦૨૨ બપોરે ૦૧.૦૦ વાગે
भिस्रहतनी विगत :	શ્રી સીતાપરા અશ્વિન વલ્લભભાઈના નામે રહેલ જમીનનો ક્ષેત્રફળ ૧૬.૯૩ ચો. મી. અવિભાજિત પ્રમાણસર હિસ્સાના સમાન ગીરો અને ૩૨૬.૪૭ ચો. ફ્રૂટ અથવા ૩૦.૩૩ ચો. મી. બિલ્ટ અપ એરિયા અને ૩૧૨.૫૮ ચો. ફ્રૂટ અથવા ૨૯.૦૪ ચો. મી. કાર્પેટ એરિયાની મર્યાદામાં બાંધવામાં આવેલી બિલ્ડીંગ, દુકાન નં. ૧૩૪, રેવન્યુ સર્વે નં. ૧૧૩/૨, બ્લોક નં. ૧૦૧, ટી.પી.એસ. નં. ૧૮ (મોટા વરાછા), ખાતા નં. ૧૯૮૦, ઓ.પી. નં. ૪૭, ફાઇનલ પ્લોટ નં. ૪૭ પર આવેલું એપલ સ્ક્વેરનો પહેલા માળે (ફાઈનલ પ્લોટ નં.૪૮ ડ્રાફ્ટ ટીપી સ્કીમ મુજબ) ગામ મોટા વરાછા, પેટા જીલ્લો સુરત શહેર (અડાજણ) જીલ્લો સુરત ખાતે આવેલી. જેની ચતુર્સીમા: ઉત્તર: કોમન પેસેજ, દક્ષિણ: સોસાયટી કોમન જમીન, પૂર્વ: શોપ નં. ૧૩૫, પશ્ચિમ:

કોમન પેસેજ વેચાણના વિગતવાર નિયમો અને શરતો માટે કૃપા કરીને સુરક્ષિત લેણદારોની વેબસાઇટ (www.tmb.in) પર આપેલી લિંકનો સંદર્ભ લો.

સ્થળ : રીંગરોડ, સુરત

અધિકૃત અધિકારી, તમિલનાડ મર્કેન્ટાઇલ બેંક લિ. અમદાવાદ રીજનલ ઓક્સિ (રીંગરોડ શાખા માટે)

## સ્ટારલાઈનપીએસ એન્ટરપ્રાઈઝીસ લીમીટેડ

બુધવાર તા.૧ જૂન ૨૦૨૨

Selic bisalc

(मूज भोजभ स्टारलार्वन प्रेसीयश स्टोन विमीटेंs) (CIN: L36910GJ2011PLC065141) રજી. ઓફિસઃ શોપ-એફ-૧, પહેલો માળ, અઠવા આર્ક શોપીંગ સેન્ટર, ચતીમખાનાની સામે, અઠવાગેટ, સુરત−૩૯૫૦૦૧, ગુજરાત. Tel.: 0261-2600343 Email: info@starlineps.com, Website: www.starlineps.com

> 39 મી માર્ચ ૨૦૨૨ ના રોજ સમાપ્ત થયેલા ત્રીમાસીક અને વાર્ષિક સમયગાળાના અલાયદા ઓડીટેડ નાણાંકીય પરીણામોનો સાર (રૂપિયા લાખમાં EPS સીવાય

વિગત	ત્રીમાસીકની સમાપ્તી			વર્ષની સમાપ્તી		
	39.03.2022	39.92.2029	39.03.2029	39.03.2022	39.03.2029	
	(ઓડીટેડ)	(अनओडीहेड)	(ઓડીટેડ)	(ઓડીટેડ)	(ઓડીટેડ)	
સંચાલન માંથી કુલ આવક (ચોષ્ખી)	450.85	363.00	544.50	9585.3	9243.66	
સમયગાળા દરમિયાનનો ચોખ્ખો નફો / (ખોટ) (કરવેરા પહેલા, અપવાદીત અને / અથવા અસાધારણ વસ્તુઓ પહેલા)	6.96	98.39	- <b>930.</b> 66	80.08	96.83	
કરવેરા પહેલાના સમયગાળા દરમિયાનનો ચોખ્ખો નફો / ખોટ (અપવાદીત અને / અથવા અસાધારણ વસ્તુઓ પછી)	6.96	98.39	-930.eu	80.08	96.83	
કરવેરા પછીના સમયગાળા દરમિયાનનો ચોખ્ખો નફો / (ખોટ) (અપવાદીત અને / અથવા અસાધારણ વસ્તુઓ પછી)	<b>4.34</b>	92.99	-923.06	30.69	99.09	
સમયગાળાની કુલ વ્યાપક આવક (સમયગાળા દરમિયાનનો વ્યાપક નફો/(ખોટ) (કરવેરા પછી) અને અન્ય વ્યાપક આવક (કરવેરાપછી)	<b>4.34</b>	92.99	-923.06	30.69	99.09	
પેઇડ અપ ઇક્વીટી શેર કેપીટલ (પ્રતિ શેર રૂા.પ/– ની મૂળ કિંમત)	૨૧૬૧.૫૦	29 <i>5</i> 9.40	<b>૨</b> ૧૬૧.૫૦	2959.U	૨૧૬૧.૫	
ભંડોળ (ગયા વર્ષની ઓડિટેડ પાકા સરવૈયા માં દર્શાવ્યા મુજબ પૂનઃમુલ્યાંકિત ભંડોળ બાદ કરતા)	-	-	-	૨૨૫.૮૧	203.6Y	
શેર દીઠ આવક (પ્રત્યેક શેર રૂા.પ/– મુજબ) (સતત અને બંધ કામગીરી માટે)						
મૂળ કિંમત ઘટાડેલી કિંમત	50.0	0.03	-0.30 -0.30	0.06	0.08	
	સંચાલત માંચી કુલ આવક (ચોખ્ખી) સમયગાળા દરમિયાતનો ચોખ્ખી નફો / (ખોટ) (કરવેરા પહેલા, અપવાદીત અતે / અથવા અસાધારણ વસ્તુઓ પહેલા) કરવેરા પહેલાના સમયગાળા દરમિયાતનો ચોખ્ખો તફો / ખોટ (અપવાદીત અતે / અથવા અસાધારણ વસ્તુઓ પછી) કરવેરા પછીના સમયગાળા દરમિયાતનો ચોખ્ખો તફો / (ખોટ) (અપવાદીત અતે / અથવા અસાધારણ વસ્તુઓ પછી) સમયગાળાની કુલ વ્યાપક આવક (સમયગાળા દરમિયાતનો વાખક નફો/(ખોટ) (કપરેશ પછી) અતે અથવા વાખક બાવક (કરવેરાપછી) પ્રેપંડ અપ પંકલીદી શેર કેપીટલ (પતિ શેર રૂપ.પ/ – તી મૂળ કિંમત) ભંડોળ (ગયા વર્ષની ઓફિડેડ પાકા સરવેયા માં દર્શાવ્યા પુષ્પ ખૂતમું હાર્યિત ભંડોળ લાદ કરતા) શેર દીઠ આવલ (પત્લેક શેર રૂપ.પ/ – મુજબ) (સતત અતે બંધ કામગીરી માટે)	વિગત 3૧.૭૩.૨૦૨૨ (અંગડીરેક) સંચાલન માંથી કુલ આવક (ચોખખી) પક્ષ્ય ૪૨ ૪૨ ૪૨ ૪૨ ૪૨ ૪૨ ૪૨ ૪૨ ૪૨ ૪૨ ૪૨ ૪૨ ૪૨	વિગત (અંગેડીરેડ) (અનસ્પેડીરેડ) (અપરાદિત અને / અસ્પા અસાધારસ વસ્તુઓ પછી) (અ.૬૮ ૧૪.૩૬) (અપરાદિત અને / અસ્પા અસાધારસ વસ્તુઓ પછી) (અ.૬૮ ૧૪.૩૬) (અપરાદિત અને / અસ્પા અસાધારસ વસ્તુઓ પછી) (અ.૬૮ ૧૪.૩૬) (અપરાદિત અને / અસ્પા અસાધારસ વસ્તુઓ પછી) (અ.૩૫ ૧૫૯ની અસ્પા અસાધારસ વસ્તુઓ પછી) પા.૩૫ ૧૨.૧૬ મામગાળાની કુલ વાપક આવક (અમગાળા દરમિયાનનો વાપક નફોપીરેડ) (અપરાદિત અને / અસ્પા અસાધારસ અસાધનો વાપક નફોપીરેડ) (અપરાદિત અને / અસ્પા અસાધારસ સ્ત્રુંએ પછી) પા.૩૫ ૧૨.૧૬ (અન્સ્પેડીરેડ) (અનસ્પેડીરેડ અપ્રાપ્ત કર્યોગ્રેડ) (અનસ્પેડીરેડ અપ્રાપ્ત કર્યોગ્રેડ) (અનસ્પેડીરેડ) (અનસ	(વગલ સાંઘલ માંઘી કુલ આવક (ચોખ્ખી) પક્ષ્યાલન માંઘી કુલ આવક (ચોખ્ખી) પક્ષ્યાલનનો ચોખ્ખી નફો / (ખોટ) (કરવેરા પહેલા, અપવાદીત અને / અથવા અસાધારાથ વસ્તુઓ પહેલા) હ.ક્દ વ ૪૪.૩૬ –૧૩૦.૯૯ ૧૪.૩૬ –૧૩૦.૯૯ ૧૪.૩૬ –૧૩૦.૯૯ ૧૪.૩૬ –૧૩૦.૯૯ ૧૪.૩૬ –૧૩૦.૯૯ ૧૪.૩૬ –૧૩૦.૯૯ ૧૪.૩૬ –૧૩૦.૯૯ ૧૪.૩૬ –૧૩૦.૯૯ ૧૪.૩૬ –૧૩૦.૯૯ ૧૪.૩૬ –૧૩૦.૯૯ ૧૪.૩૬ –૧૩૦.૯૯ ૧૪.૩૬ –૧૩૦.૯૯ ૧૪.૩૬ –૧૩૦.૯૯ ૧૪.૩૬ –૧૩૦.૯૯ ૧૪.૩૬ –૧૩.૦૯ ૧૪.૩૯ ૧૪.૩૬ –૧૩.૦૯ ૧૪.૩૯ ૧૪.	(વંગત) સુરાયાલન માંચી લુલ આવક (ચોખ્ખી) પક્ષ્મ પહેલા, અપાર્થાદા લાગ્યાલાના ચોખ્ખી નફ) / (ખોટ) (કરવેશ પહેલા, અપાર્થાદાના સાથે આવક સાથા સાથા સરફાઓ પછી ખક્ષ છે. કરવેશ પહેલા, અપાર્થાદાના સરફાઓ પછી ખક્ષ છે. કરવેશ પહેલાના સમસગાળા દરમિયાનાનો ચોખ્ખો નફ) / ખોટ (અપાર્થાદાના અને ) અથવા અસાધારાશ વસ્તુઓ પછી ખાટે (અપાર્થાદાના અને ) અથવા અસાધારાશ વસ્તુઓ પછી પછી (ઓટ) (અપાર્થાદાત અને ) અથવા અસાધારાશ વસ્તુઓ પછી પછી અને અલ વાયક આવક (સમગળા દરમિયાનનો ચોખ્ખો નફ) / પાત્રેય વર્ષાયા અસાધારાશ વસ્તુઓ પછી પાત્રેય વરાય અસાધારાશ અસ્ત્રો પાત્રેય વર્ષાયા અને (અથવા અસાધારાશ સર્વાયો અલે અલ વાયક આવક (અસ્ત્રો ખાઇ) પાત્રેય પાત્રેય અપાર્થ અપાર્થા અને અલ વાયક આવક (સર્વાયા પાત્રેયા પાત્રેયા પાત્ર અપાર્થા અને અલ વાયક આવક (સર્વાયામાં પાત્રેયા પાત્ર પાત	

. સેબીના (લીર્સ્ટીગ અને અન્ય જાહેરાતો માટે જરૂરી) નીયમ ૨૦૧૫ ની કલમ ૩૩ મુજબ ૩૧–૦૩–૨૦૨૨ ત્યા રોજ સમાપ્ત થતા ત્રીમાસીક અને વાર્ષિક નાણાંકીય પરિણામોનો ઢુંક સાર ઉપર આપવામાં આવ્યો છે. ત્રીખુસીક અને વાર્ષિક અન્વેષિત નાણાંકિય પરિણામ સ્ટોક એશ્યેન્જની વેબસાઈટ એટલે કે websites: www.bseindia.com અને કંપનીની વેબસાઈટ www.starlineps.com પર સંપૂર્ણ

ર. ઉપરોક્ત નાંણાકિચ પરીણામોને ઓડિટ કમીટી દ્વારા ધ્યાને લેવામાં આવ્યા હતા અને તા.૩૦મી મે ૨૦૨૨

ા રોજ મળેલી બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મીટીંગમાં મંજુરી આપવામાં આવી હતી. 3. ઉપરોક્ત નાણાકીય પરીણામો ઇન્ડીયન એકાઉન્ટીંગ સ્ટાન્ડર્ડ (આઇએનડીએએસ) ના કંપની એક્ટ ૨૦૧૩ ની કલમ ૧૩૩ તેના અંતર્ગત સૂચીત કાયદાઓ અને સુચનાઓ મુજબ તૈયાર કરવામાં આવ્યા છે. સ્ટારલાઈનપીએસ એન્ટરપ્રાઈઝીસ લીમીટેડ, વતી (भूज ओजज स्टारलार्धन प्रेसीयश स्टोन लिमीटेंड)

> સહ<del>]/-</del> શ્વેતકુમાર કોરડીયા ચેરમેન એન્ડ મેનેજીંગ ડીરેક્ટર DIN: 03489858

di: 30-04-5055 તમિલનાડ મર્કન્ટાઇલ બેંક લિમિટેડ TΜB

સ્થળઃ સુરત

સુરત શાખા : ઓફિસ બિલ્ડીંગ કોમ્પલેક્ષ, બોમ્બે માર્કેટ, સુરત મેઈન શાખા, સુરત-૩૯૫૦૧૦, ગુજરાત

CIN-U65110TN1921PLC00190 E-mail:-surat@tmbank.in| क्षेत्रः०२६९ २उ५५००३, २उ९९२७९

## નિચમ ૮(૧) કબજા નોટીસ (સ્થાવર મિલકત માટે)

આથી તમિલનાડ મર્કેન્ટાઇલ બેંક લીમીટેડના નીચે સહી કરનાર અધિકૃત અધિકારીએ સિક્યોરિટાઇઝેશન અને રિકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્સિયલ એસેટ્સ અને એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરિટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ હેઠળ અને સિક્યોરિટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ ના નિયમ ૩ સાથે વંચાતી કલમ ૧૩(૧૨) હેઠળ મળેલ સત્તાનો ઉપયોગ કરીને ૧૭.૦૩.૨૦૨૨ ના રોજ માંગણા નોટીસ જારી કરી દેવાદાર મેસર્સ રાજશ્રી ઇન્ડસ્ટીઝ. પ્લોટ નં. ૨૦,૫હેલો માળ, સાંઈ લીલા ઈન્ડસ્ટ્રીચલ સોસાચટી, ઉઘના બસ ડેપો પાછળષ ઉદ્યના, સુરત-૩૯૪૨૧૦, પ્રોપરાયટર / ગીરેવદાર શ્રી રામનારાયણ અંબાલાલ ટેલર, જે અંબાલાલ ટેલરના પુત્ર , એ-૩૦૪ ક્ષી વંદન રેસીડેન્સી, દેલડાવા, ચોર્ચાસી,. સરત ૩૯૫૦૧૦, જામીદાર છ શ્રી ભેરુદન એસ. પારેખ, જે સંપતમલ પારેખના પુત્ર, ફ્લેટ નં. ડી-૬૦૨, છઠ્ઠો માળ, ૠષિ વિહાર ટાઉનશીપ, કી બિલ્કીંગ, પર્વત રોક, સુરત-૩૯૫૦૧૦, જામીદાર : શ્રી વેષ્ણવ નાથુદાસ લક્ષ્મણદાસ જે લક્ષ્મણદાસ એચ. વેષ્ણવના પુત્ર, નં. ૩૦૧, શ્રી રેસીડેન્સી, માનસરોવર સોસાયટી, ગોદાદરા, સુરત-૩૯૫૦૧.સાથે અમારી રીંગ રોડ શા<mark>ખાના નો</mark>ટીસમાં જણાવેલ ૨કમ **રૂા.૧,૪૯,૬૪,૮૧૨.૯૮/- (રૂપિયા એક કરોડ** એ) ગામુપચાસ લાખ ચોસઠ હજાર આઠસો બાર અને અઠાણું પૈસા પુરા) ૨૮.૦૨.૨૦૨૨ ર્મુજુબની કેશ ક્રેડીટ રૂા. ૧,૨૯,૧૫,૩૦૮.૯૮ જે તા. ૨૮-૦૨-૨૦૨૨ અને ટર્મ લોન √જીઈસીએલ) ની રકમ રૂા. ૨૦,૪૬,૫૦૪.૦૦ જે તા. ૨૮-૦૨-૨૦૨૨, આ નોટીસ મળ્યાની તારીખથી ૬૦ દિવસની અંદર ચુકવવા જણાવ્યું હતું. અમે ૧૮.૦૩.૨૦૨૨ ના અખબારમાં ડિમાન્ડ નોટિસ પ્રકાશિત કરી છે.

દેવાદાર રકમની પરત ચુકવણી કરવામાં નિષ્ફળ ગયા હોવાથી દેવાદાર અને જાહેર ૪નતાને નોટીસ આપવામાં આવે છે કે નીચે સહી કરનારે સિક્યોરીટી ઇન્ટરેસ્ટ એન્ફોર્સમેન્ટ નિયમો, ૨૦૦૨ ના નિયમ ૮ સાથે વંચાતી જણાવેલ એક્ટની કલમ ૧૩(૪) હેઠળ તેમને પ્રાપ્ત સત્તાનો ઉપયોગ કરીને નીચે જણાવેલ મિલકતનો કબજો **તા. ૩૧ મે ૨૦૨૨** ના રોજ લઇ લીધો

સિક્યોર્ડ એસેટ પરત મેળવવા માટે ઉપલબ્ધ સમયના સંબંધમાં એક્ટની કલમ ૧૩ ની પેટા કલમ (૮)ની જોગવાઇઓ પ્રત્યે દેવાદારોનું ધ્યાન દોરવામાં આવે છે.

ખાસ કરીને દેવાદાર અને જાહેર જનતાને મિલકત સાથે કોઇ સોદો ન કરવા સાવધ કરવામાં આવે છે, મિલકત સાથેનો કોઇપણ સોદો તમિલનાડ મર્કેન્ટાઇલ બેંક લીમીટેડ, કુલ ૨કમ રૂા.૧,૫૨,૮૦,૧૨૬.૯૮/- (રૂપિયા એક કરોડ બાવન લાખ ઐંસી હજાર એક્સો છવ્વીસ **અને અઠાણું પૈસા પુરા)** લોન એકઉન્ટ મુજબ તા. ૩૦-૦૪-૨૦૨૨ (ક્રેશ કેડીટ રકમ **રૂા,** ૧,૩૧,૯७,૪૩૧.૯૮ અને ટર્મ લોન **રૂા. ૨૦,૮૨,૬૯૫** મુજબ ૩૦.૦૪.૨૦૨૨ થી ચડત વ્યાજ અને તેના પરના ખચર્ના ચાર્જને આધિન રહેશે

# સ્થાવર મિલકતનું વર્ણન

<mark>૧. શ્રી રામનારાચણ અંબાલાલ દરજીના</mark> નામે આવેલ અવિભાજિત પ્રમાણસર હિસ્સા ની જમીન અને મકાન માં બાંધવામાં આવેલ હદ સુધીનું ૨૫.૩૩ ચો. મી. અથવા ૨૭૨.૫૦ ચો. ફૂટ કાર્પેટ વિસ્તાર અને ૨૭.૧૧ ચો.મી. અથવા ૨૯૧.૭૦ ચો. ફૂટ બીલ્ડઅપ વિસ્તાર અને ૫૦.૬૫ ચો. મી. અથવા ૫૪૫ ચો. મી. સુપર બિલ્ટઅપ વિસ્તાર માં ૬.૮૪ ચોરસ મીટર ના હિસ્સા સાથે ની જમીન પર ધરાવતી શોપ નં. જી-૩૮ પર સ્થિત રેવન્યુ સર્વે નં. ૫૮૦/૧, ૫૯૨/૧, ૫૯૩, ૫૯૫, બ્લોક નં. ૬૩૧, ૬૭૧/બી, ટી.પી.એસ. નંબર ૧૨ (પુના),એફ.પી. નંબર ૨૪/૧, ૪૫/૨, ઇન્ટરનેશનલ ફેશન માર્કેટ, ગ્રાઉન્ડ ફ્લોર,રાજ મહેલ એ/સી મોલ ની સામે, પુના ગામ રોડ, પુના, તા. સુરત શહેર: સુરત. જેની ચર્તુસીમા : ઉત્તર : પેસેજ પછી ખુલી જગ્યા, દક્ષિણ : ઓ.ટી.એસ., પૂર્વ : દુકાન નં. જી-૩૯,

પશ્ચિમઃસીડી પછી દુકાનનં.જી-૩૭

**૨. શ્રી રામનારાયણ અંબાલાલ દરજીના** નામે આવેલ અવિભાજિત પ્રમાણસર હિસ્સા ની જમીન અને મકાન માં બાંધવામાં આવેલ હદ સુધીનું ૨૫.૩૩ ચો. મી. અથવા ૨૭૨.૫૦ ચો. ફ્ટ કાર્પેટ વિસ્તાર અને ૨૬.૬૩ ચો.મી. અથવા ૨૮૬.૫૪ ચો. ફટ બીલ્ડઅપ વિસ્તાર અને ૫૦.૬૫ ચો. મી. અથવા ૫૪૫ ચો. મી. સુપર બિલ્ટઅપ વિસ્તાર માં ૬.૭૨ ચોરસ મીટર ના હિસ્સા સાથે ની જમીન પર ધરાવતી શોપ નં. જી-૩૯ પર સ્થિત રેવન્યુ સર્વે નં. ૫૮૦/૧, ૫૯૨/૧, ૫૯૩, ૫૯૫, બ્લોક નં. ૬૩૧, ૬૭૧/બી, ટી.પી.એસ. નંબર ૧૨ (પુના),એફ.પી. નંબર ૨૪/૧, ૪૫/૨, ઇન્ટરનેશનલ ફેશન માર્કેટ, ગ્રાઉન્ડ ફ્લોર,રાજ મહેલ એ/સી મોલ ની સામે, પુના ગામ રોડ, પુના,

તા. લુસ્ત મુક્ત, લુસ્ત, જેની ચર્તુસીમા : ઉત્તર : પેસેજ પછી ખુલી જગ્યા, દક્ષિણ : ઓ.ટી.એસ., પૂર્વ : દુકાન નં. જી-૪૦, પશ્ચિમ : દુકાન નં. જી-૩૮

અધિકૃત અધિકારી તામિલનાડ મેર્કન્ટાઇલ બૈંક લિ. મદાવાદ રીજાનલ ઓફિસ સુરત રીંગ રોડ શાખા માટે)

# મેગા ઈ-હરાજી વેચાણ નોટીસ สเวโน : 17-กด-วกวว

ROSARB સુરત શહેરી ક્ષેત્ર, ત્રીજો માળ, બરોડા સન કોમ્પલેક્ષ, ઘોડદોડ રોડ સુરત ફોન : 0261 સિક્યુરિટાઈઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્શીયલ એસેટ્સ અને એન્ફોર્સમેન્ટ ઓફ સિ એક્ટ 2002ના રૂલ્સ 6(2) અને રૂલ્સ 6(6) સાથે વંચાણે લક્ फ़ बड़ौदा

स्वर्गः सुरत	or-ioraic eligorer of	mati Gee	ciel cio (ii	-11 -110)
-2294302/03/04/05,9499555	.022 7972395690			
		<b>1</b> //22	बैंक ऑफ़	बड़ीदा
ાં સુરક્ષિત મિલકતોનું વેચાણ.	2102161408)		बैंक ऑफ़ Bank of B	<i>Paroda</i>
O			4 from 19	

તારીખઃ ૩૧.૦૫.૨૦૨૨

		/-UD-ZUZZ				Duiouu
આથી અહીં જાહેર જનતા અને ખાસકરીને કરજદારે તથા જમીનદારોને નોટીસ આપવામાં આવે છે કે, નીચે જણાવેલ સ્થાવર/જંગમ મિલકતો કે જે બેંક ઓક્ બરોડાને મોર્ગેજ/ચાર્જ છે, જેનો કબજો બેંક ઓક્ બરોડાના અધિકૃત સમય ઃ બપોરે 2.00 થી 6.00 અધિકારી દ્વારા લેવામાં આવેલ છે. નીચે જણાવેલ ખાતાઓની મિલકતો બેંકના બાકી લેણાં વસુલવાના ધોરણે "જેમ છે", "જ્યાં છે", "ત્યાં જેમ છે તેમ", અને કોઠપણ પ્રકારના આશ્રયના આધાર વિના વેચાણકરવામાં આવશે.						D - BOWN
	ક્રમ કરજદાર/ડિમાન્ડ નોટીસ તારીખ	મિલકતના માલિક	મિલકતોનું વર્ણન	भिલકતનો પ્રકાર	બાકી રકમ (રૂા.લાખમાં) + વ્યાજ અને અન્ય ખર્ચાઓ	અનામત ફિંમત ઈએમડી (રૂા.લાખમાં)
	ચોગેશકુમાર મનસુખભાઈ ગજેરા મનસુખભાઈ પોપટભાઈ ગજેરા, વિમલભાઈ મનસુખભાઈગજેરા 10/07/2019	, ચોગેશકુમાર મનસુખભાઈ ગજેરા	પ્લોટ નં. 770 (પાર્સીગ પ્લાન પ્રમાણે પ્લોટ નં. એ/770)," શ્રી રુદ્રા રેસિડેન્સી", શેખપુર, રેવન્થુ સર્વે નં. 287+291/1+288+292+293+294, બ્લોક નં. 242, મોજે શેખપુર, વેલંજા રોડ, તા. કામરેજ, ડિસ્ટ. સુરત પ્લોટ એરિયા - 801 થો. ફુટ અને બિલ્ટઅપ એરિયા 255.21 થો. ફુટ. (પ્રત્થક્ષ કબજો)	રહે. ઘર	16.20 તા.30-06-2019 સુધીના વ્યાજ સહીત	13.77
	2. ਪੇਰੇશਵ ક્રિએશન 25-07-2019	સુરેશભાઈ ગોરધનભાઈ સોનાણી	રેવન્થુ સર્વે નં.15 પૈકી 16/1 પૈકી 17 પૈકી , ટી.પી.સ્કીમ નં.16 (કાપોદ્રા), ફાઈનલ પ્લોટ નં.23&32 , <mark>કમલપાર્ક કો.ઓપ. હાઉસિંગ સોસાયટી વિભાગ</mark> - <b>2 પ્લોટ નં.B</b> /13 , સાગર સોસાયટીની બાજુમાં , <mark>એલ.એચ.રોડ</mark> , કાપોદ્રા , તા.સુરત સિટી , જી.સુરત . એરિચાઃ 62 .71 ચો.મી.એટલે કે 75 ચો.ચાર્ડ	રહે.ઘર	77.74 તા.31-03-2019 સુધીના વ્યાજ સહીત	50.92 5.10
	ં જીતેન્દ્ર હરિભાઈ કાલાવડિયા, પન્નાબેન જાતેન્દ્રભાઈ	જીતેન્દ્રભાઈ હરિભાઈ કાલાવડિયા	ફ્લેટ નં. 103, પહેલો માળ, "હરે કૃષ્ણ રેસીડેન્સી" (સીમંધર નગર સોસાયટી), દાદા ભગવાન મંદિર પાસે, બ્લોક નં. 357 પૈકી -2, પૈકી પ્લોટ નં. એ-10, એ-11, એ-12, બી-9, બી-10, બી-11 અને બી-12 (મંજુર પ્લાન મુજબ પ્લોટ નં. 9, 10 અને 11 મુજબ) મોજે કામરેજ, સબ ડિસ્ટ્રી. કામરેજ, જિ. સુરત. વિસ્તાર - બિલ્ટ અપ એરિયા - 60.59 ચો.મી. એટલે કે 652.19 ચો.કુટ.	ફ્લેટ	20.67 તા.15-11-2017 સુધી	8.89 0.89
	કાલાવડિયા   15-11-2017 4.	પન્નાબેન જીતેન્દ્રભાઈ કાલાવડિયા	ફ્લેટ નં. 407, ચોથો માળ, "હરે કૃષ્ણ રેસીડેન્સી" (સીમંધર નગર સોસાથટી), દાદા ભગવાન મંદિર પાસે, બ્લોક નં. 357 પૈકી -2, પૈકી પ્લોટ નં. એ-10, એ-11, એ-12, બી-9, બી-10, બી-11 અને બી-12 (મંજુર પ્લાન મુજબ પ્લોટ નં. 9, 10 અને 11 મુજબ) મોજે કામરેજ, સબ ડિસ્ટ્રી. કામરેજ, જિ. સુરત. વિસ્તાર - બિલ્ટ અપ એરિયા - 41.26 થો.મી. એટલે કે 444.12 થો.કુટ.	કલેટ	વ્યાજ સાથેની રકમ	5.63 0.57
	5.	ાન   01-01-2020   રૂપલ મેહલભાઈ કાકડીયા	ફ્લેટ નં.601, છઠ્ઠો માળ, "રાજ રિવેરા" બિલ્ડિંગ, અદ્મિનીકુમાર રોડ, સિટી સર્વે નોંધ નં.332, 333, 334, 335, 336 & 337, વોર્ડ - કુલપાડા-1, ગામતળ, તા.સુરત સિટી, જી. સુરત. સુપર બિલ્ટ અપ એરિયાનું કુલ અંદાજીત માપ આશરે 2443.00 ચો.કુટ એટલે કે 227.045 ચો.મી., અને બિલ્ટ અપ એરિયા 147.58 ચો.મી.જમીનની નીચે, દાદર અને કોમન પેરોજમાં અવિભાજીત પ્રમાણસર હિસ્સા સાર્થે અંદાજીત માપ આશરે 79.47 ચો.મી.	ફ્લેટ		52.00 5.20
	 6. — ઓમ કેશન ∣ 01-01-2020		ફ્લેટ નં.602, છઠ્ઠો માળ, "રાજ રિવેશ" બિલ્ડિંગ, અધિનીકુમાર રોડ, સિટી સર્વે નોંધ નં.332, 333, 334, 335, 336 & 337, વોર્ડ - ફુલપાડા-1, ગામતળ, તા. સુરત સિટી, જી. સુરત. સુપર બિલ્ટ અપ એરિયાનું કુલ અંદાજીત માપઆશરે 675.00 ચો.કુટ એટલે કે 62.73 ચો.મી., અને બિલ્ટ અપ એરિયા 40.77 ચો.મી.જમીનની નીચે, દાદર અને કોમન પેસેજમાં અવિભાજીત પ્રમાણસર હિસ્સા સાથે અંદાજીત માપ આશરે 21.96 ચો.મી.	ફ્લેટ	148.80 + વ્યાજ	14.37
	7.	इनस निरुक्तिमाठ ठाउँजाया	ફ્લેટ નં. 602, છઠ્ઠો માળ, " <b>વી-રાજ વ્યુ" બિલ્ડિંગ, અધિનીકુમાર રોડ</b> , સિટી સર્વે નોંધ નં. 13 & 14 વોર્ડ - કુલપાડા-1, ગામતળ, તા. સુરત સિટી, જી. સુરત. સુપર બિલ્ટ અપ એરિયાનું કુલ અંદાજીત માપ આશરે 2275.00 ચો.કુટ એટલે કે 211.43 ચો.મી., અને બિલ્ટ અપ એરિયા 154.34 ચો.મી. જમીનની નીચે, દાદર અને કોમન પેસેજમાં અવિભાજીત પ્રમાણસર હિસ્સા સાથે અંદાજીત માપ આશરે 37.17 ચો.મી.	ફ્લેટ	140.00 + 0014	48.45 4.85
	-		ફ્લેટ નં. 601, છઠ્ઠો માળ ," <mark>વી-રાજ વ્યુ" બિલ્ડિંગ, અધ્ધિનીકુમાર રોડ</mark> , સિટી સર્વે નોંધ નં. 13 & 14 વોર્ડ - ફુલપાડા-1 , ગામતળ , તા. સુરત સિટી , જી. સુરત . સુપર બિલ્ટ અપ એરિયાનું ફુલ અંદાજીત માપ આશરે 800.00 ચો .કુટ એટલે કે 74.35 ચો.મી. , અને બિલ્ટ અપ એરિયા 54.28 ચો.મી. જમીનની નીચે , દાદર અને કોમન પેસેજમાં અવિભાજીત પ્રમાણસર હિસ્સા સાથે અંદાજીત માપ આશરે 20.07 ચો.મી.	ફ્લેટ		17.00 1.70
	છે. કે.ડી. એન્ટરપ્રાઈઝ અનિષાબાનુ મો.ઈલ્યાસ મોરીસવાલા	અનિષાબાનુ મો.ઈલ્યાસ મોરીસવાલા	વોર્ડ નં 8, નોંધ નં.862, " <mark>ખાલીદ શાહ કોમ્પલેક્ષ"</mark> , ચોથો માળ, <del>ફલેટ નં.</del> 402, હુસેની ચોક નજીક, કેશવબાગ એપાર્ટમેન્ટ પાછળ, મોમનાવાડ સ્ટ્રીટ રોડ, <b>ગોપીપુરા મોમનાવાડ</b> , તા. સુરત સિટી, જી. સુરત. એરિચા : સુપર બિલ્ટ અપ એરિચા 650.00 ચો.કુટ એટલે કે 60.37 ચો.મી., બિલ્ટ અપ એરિચા : 556.80 ચો.કુટ એટલે કે 51.73 ચો.મી.	ક્લેટ	384.28 di.31-12-2020	14.50 1.45
	09-08-2019	મો.ચુનુસ અબ્દુલ રહીમ મોરીસવાલા	વોર્ડ નં 8, નોંધ નં 862, " <b>ખાલીદ શાહ કોમ્પલેક્ષ</b> ", ચોથો માળ , <b>ફ્લેટ નં .</b> 405, હુસૈની ચોક નજીક , કેશવબાગ એપાર્ટમેન્ટ પાછળ , મોમનાવાડ સ્ટ્રીટ રોડ , <b>ગોપીપુરા મોમનાવાડ</b> , તા . સુરત સિટી , જી . સુરત . એરિયા :સુપર બિલ્ટ અપ એરિયા 600.00 ચો કુટ એટલે કે 55.74 ચો .મી.	ફ્લેટ	સુધીના વ્યાજ સહીત	14.50 1.45

કરજદાર / જામીનદાર / મોર્ગેજરને સરફેસી એક્ટ હેઠળ 15 દિવસીય કાયદાકીય વેચાણ નોટીસ.

વેચાણના નિયમો અને શરતો અંગેની વધુ માહિતી માટે https://www.bankofbaroda.in/e-auction.htm,https://ibapi.in તથા અધિકૃત અધિકારી : ફોન : 0261-2294302/03/04/05, મો.9499555022/7972395690 નો અને www.mstcecommerce.com પર સંપર્ક કરો. (આ હરાજી નોટીસનું અંગ્રેજીમાંથી અન્ય ભાષામાં અનુવાદ કરતી વખતે કોઈ ક્ષતિ થયેલ જણાશે તો અસલ અંગ્રેજી લખાણ જ માન્ય ગણાશે)

તારીખ : 01-06-2022 | સ્થળ : સુરત | મિલકતની મુલાકાત માટે સંપર્ક : સંજય કુમાર સિંહા - 7972395690 અધિકૃત અધિકારી, બેંક ઓફ બરોડા.

સ્થળ : રીંગરોડ, સુરત તારીખઃ ૩૧.૦૫.૨૦૨૨

નં.૨૧ ( સરથાણા-સિમડા), ફાઈનલ પ્લોટ નં. ૫૮/૧ સબ પ્લોટ નં.૨, સરથાણા નેચર પાર્ક પાસે, સરથાણા-જકાતનાકા, સુરત-કામરેજ રોડ, ગામ-સરથાણા, તા. કામરેજ (પુના), સુરત ખાતે આવેલા છે. જેની માલીકી શ્રી પિયુષ પોપટભાઈ કથારોટીયાના નામે છે. જેની ચતુર્સીમા ઉત્તરઃ પેસેજ, દક્ષિણઃ સંલગ્ન મિલકતા, પૂર્વઃ ઓફિસ નં. ૪૦૪, પશ્ચિમઃ ઓફિસ નં. ૪૦૬ ૩. સમાન ગીરો ના અવિભાજિત પ્રમાણસર હિસ્સા ની જમીન ક્ષેત્રફળ ૩૩૦.૦૦ ચો.ફૂટ અથવા

૩૦.૬૭ ચો.મી. જેનો બિલ્ડ અપ એરિયા અને ૨૭૫.૦૦ ચો.મી. અથવા ૨૫.૫૬ ચો.મી. કાર્પેટ એરિયા, ઓફિસ નં. ૪૦૬, રાઇઝ ઓન પ્લાઝા, ૪થા માળે, રાજહંસ સ્વપ્નની સામે, આર.એસ. નં. ૧૪૭, બ્લોક નં.૧૪૪/ બી, બ્લોક નં.૧૪૪/બી/૨, ૭/૧૨ મુજબ, ટી.પી.એસ. નં.૨૧ ( સરથાણા-સિમડા), ફાઈનલ પ્લોટ નં. ૫૮/૧ સબ પ્લોટ નં.૨, સરથાણા નેચર પાર્ક પાસે, સરથાણા-જકાતનાકા, સુરત-કામરેજ રોડ, ગામ-સરથાણા, તા. કામરેજ (પુના), સુરત ખાતે આવેલા છે. જેની માલીકી શ્રી પિયુષ પોપટભાઈ કથારોટીયાના નામે છે. જેની ચતુર્સીમા ઉત્તરઃ પેસેજ, દક્ષિણઃ સંલગ્ન મિલકતા, પૂર્વઃ ઓફિસ નં. ૪૦૫, પશ્ચિમઃ ઓફિસ નં. ૪૦૭

વેચાણના વિગતવાર નિયમો અને શરતો માટે કૃપા કરીને સુરક્ષિત લેણદારોની વેબસાઇટ (www.tmb.in) પર આપેલી લિંકનો સંદર્ભ લો.

અધિકૃત અધિકારી, તમિલનાડ મર્કેન્ટાઇલ બેંક લિ. અમદાવાદ રીજનલ ઓફિસ

(રીંગરોડ શાખા માટે)

Printed by Manojbhai Laljibhai Mistry at GUARDIANPRESS B-17/2, Hojiwala Industrial Estate, Sachin-Palsana Road, Near Sachin, Palsana Road, Near Sachin, Surat on behalf of owners Manojbhai Laljibhai Mistry & Published by Manojbhai Laljibhai Mistry at Guardian House, Suman Desai ni Wadi, Udhna Darwaja, Ring Road, Surat-395002 on behalf of owners Manojbhai Laljibhai Mistry & Dublished by Manojbhai Mistry & D